



29.07.2007 21:23

જુન - ૨૦૦૬

## અનુક્રમણિકા

ક્રમ	કૃતિ	પાના નં.
૧	કિર્તન - અલબેલા	૨
૨	દુર્ગપુર માહાત્મ્ય	૩
૩	બ્રહ્મરાક્ષસ - ૧૨	૫
૪	વૃક્ષમાંથી વારસદાર	૬
૫	અંતરના અવાજને ઓળખો	૮
૬	ભક્તરાજ દરબારશ્રી દાદાખાચરનું જીવન ચરિત્ર	૧૦
૭	અ.નિ.સ્વામીશ્રી જગત પ્રકાશદાસજીના મુખેથી રત્નકણીકા	૧૪
૮	ઈસપગોળ(આર્યુવેદિક)	૧૬
૯	સત્સંગ સમાચાર	૧૮
૧૦	શ્રી ગોપીનાથજી મહારાજના આખા થાળની યાદી માહે-એપ્રિલ-૦૬માં શ્રીગોપીનાથજીમહારાજ નો થાળ તથા ત્યાગી સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને	૨૦
૧૧	આપવામાં આવેલ રસોઈના દાતાઓની યાદી અષાઢ મહિનામાં થનાર અનામત તીથીની	૨૬
૧૨	રસોઈની યાદી	૨૮

**ગઢપુર ધામનો મહિમાં અને દર્શન માટે**  
**ગઢપુર મંદિરની વેબસાઈટ જુવો**  
**www.Gopinathji.com**

માલિક, મુદ્રક તથા પ્રકાશન : શ્રી સ્વામિનારાયણ મંદિર, ટેમ્પલ મેનેજીંગ બોર્ડ વતી, સદરહું મંદિરના મુખ્ય કોઠારી શ્રી શા.સ્વા. ધનશ્યામવલ્લભદાસ જી. ગઢડા (સ્વા.) જિ. ભાવનગર,  
**ફોન નં. (૦૨૮૪૭) ૨૫૨૮૦૦, ફેક્સ નં. ૨૫૨૮૦૦.**

મુદ્રણ સ્થાન : વૃંદાવન ઓફસેટ (શ્રી ગોપીનાથજી પ્રી. પ્રેસ), જુના બસસ્ટેશન સામે, બોટાદ રોડ, ગઢડા (સ્વા.) જિ.ભાવનગર



**કીધું અધિક ગઢપૂર,**  
**સાત પુરી ચાર ધામથી જો ;**  
**પ્રેમાનંદ કહે ચમ દુત,**  
**ભાગે ગોપીનાથ નામથી જો.**

### શ્રી સ્વામિનારાયણ ધર્મસિધ્ધાંત

વર્ષ : ૨૭ - સર્ગ અંક : ૩૨૬  
 જુન - ૨૦૦૬

: સંચાલક તંત્રી :

કોઠારી શા.સ્વા.ધનશ્યામવલ્લભદાસજી  
 શ્રી ગોપીનાથજીદેવ મંદિર  
 ગઢડા (સ્વામિના.)

: વાર્ષિક સભ્ય પદ :

રૂપિયા ત્રીસ

: આજીવન સભ્ય પદ :

રૂપિયા ત્રણસો

: વિદેશમાં આજીવન સભ્ય પદ :

બે હજાર

: છુટક નકલ :

રૂપિયા ત્રણ

: પત્ર વ્યવહારનું સરનામું :

શ્રી સ્વામિનારાયણ મંદિર મુખ્ય  
 ગઢડા - ૩૬૪૭૫૦

**ફોન: ૨૫૨૮૦૦/૨૫૨૮૦૦**

## : અગત્યના સુચનો :

“શ્રી સ્વામિનારાયણ ધર્મ સિધ્ધાંત” શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા પ્રકાશીત થતું મુખપત્ર છે.

“શ્રી સ્વામિનારાયણ ધર્મ સિધ્ધાંત” ભગવાનશ્રી સ્વામિનારાયણના ધર્મ સિધ્ધાંતોના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશથી પ્રકાશિત થાય છે.

તમામ હરિભક્તોને આ માસિક પત્રના સભ્ય બનીને આ ધર્મપ્રચારના કાર્યને વેગ આપવા જાહેર અપીલ છે.

તા. ૨૦ સુધીમાં અંક ન મળેતો પ્રથમ પોસ્ટ ઓફિસમાં તપાસ કર્યા બાદ કાર્યાલયને લેખિત જાણ કરવી.

દરેક પત્ર વ્યવહારમાં ગ્રાહક નંબર અવશ્ય લખવો.

## : લેખકોને :

**ખાસ નોંધ :- લેખનું લખાણ**

**કાગળની એક બાજુએ**

**સ્વચ્છ અક્ષરે લખીને**

**મોકલવું.**

લખાણ સંપ્રદાયના માન્ય શાસ્ત્રોના સિધ્ધાંતો અનુસાર હોવું જોઈએ.

૦૦૦૦ — ૦૦૦ — ૦૦૦૦

સત્સંગ સમાચારો-સંસ્થા સમાચારો વગેરે જે કાંઈ હોય તે સંક્ષિપ્તમાં અને બનેલ હકિકત આધારે મુદ્દાસર મોકલવા.

## કિર્તન

પદ-૬

**અલબેલા**

અલબેલા આવો મારે ઘેર,  
કે જાઉં તારે વારણે રે લોલ,  
પહેરાવું ચંપાના હાર,  
કે લાવી છું તમ કારણે રે લોલ...૧  
રસિયા બાંધી રૂપાળી પાઘ,  
આંટો લેજો બેવડો રે લોલ,  
ઓરા આવોને સુંદર છેલ,  
કે ખોસું કેવડો રે લોલ...૨  
લટકાં કરતાં આવો લાલ,  
શેરીના ચોકમાં રે લોલ,  
પ્રાણજીવન જોવાને કાજે,  
બેસીશ હું તો ગોખમાં રે લોલ...૩  
આવીને બેસો મારે બાર,  
કરો રૂડી વાતડી રે લોલ,  
રસિયા જોઈ તમારું રૂપ,  
ઠરે છે મારી છાતડી રે લોલ...૪  
લાલચ લાગી છે અલબેલ,  
મોહી છું તારા વેણમાં રે લોલ,  
આવો પ્રેમસખીના પ્રાણ,  
રાખુ મારા નેણમાં રે લોલ...૫



રજુ : ભરત એલ.સવાણી  
ગઢડા



# દુર્ગપુર માહાત્મ્ય

શા.સ્વા. છપ્પેસામ્રકાશદાસજી - ગઢપુર(સ્વા.)



**ગતાંકથી શરૂ :-**

વળી તે જ દરબારગઢમાં મોટા ઓટાવાળાં અને મોટા બારણાવાળાં ઓરડામા એકઠાળીયામાં, ઘરની બંને ઓસરીઓમાં શ્રીહરિ વારંવાર બિરાજતા હતા. જીવાખાચરના દરબારગઢના આગલા ભાગમાં શેરી છે. તેમાં લખીબાઈના ઘર રહેલા છે. તેની પાસે ધર્મશાળા હતી. તે ધર્મશાળામાં શ્રીહરિ ઘણો સમય નિવાસ કરતા હતા. આ પ્રકારે જીવાખાચરનો તમામ દરબારગઢ અતિપવિત્ર છે. શ્રીહરિ પ્રભુ ગઢપુરક્ષેત્રમાં ઘરઘર પ્રતિ, શેરીશેરી પ્રતિ, અને માર્ગમાર્ગ પ્રતિ પધારેલા છે, વિચરેલા છે અને બિરાજેલા છે. તેથી ગઢપુરતીર્થ અતિ ઉત્તમ તીર્થક્ષેત્ર છે, અતિદિવ્યતીર્થક્ષેત્ર છે. ॥૨૪॥

શ્રીચૈતન્યાનંદસ્વામી કહે છે હે રાજન્ ! શ્રીહરિપ્રભુ ગઢપુરની ચારે તરફ રહેલા સ્થાનોમાં વિચરેલા છે અને દિવ્યઐશ્વર્યો બતાવેલા છે. અમરાખાચર પૂછે કે હે બ્રહ્મન્ ! શ્રીહરિ ગઢપુરની આસપાસ રહેલા જે જે સ્થાનોમાં ફરેલા હોય અને દિવ્ય ઐશ્વર્યો બતાવ્યા હોય તે તે સ્થાનો કહેવા કૃપા કરો. શ્રીચૈતન્યાનંદસ્વામી કહેવા લાગ્યા કે હે રાજન્ ! જ્યારે ચાતુર્માસમાં વર્ષાદિથી નદીમાં પૂર આવતું હતું ત્યારે શ્રીહરિ જોવા

પધારતા હતા. અને પછી કોઈ એક સમયે શ્રીહરિએ જીવાખાચરના દરબારગઢમાં સુંદર મંદિર કરવાની ઈચ્છા કરી. કારીગરને બોલાવી માપ પણ કરાવ્યું અને તે દરબારગઢથી આરંભી ખળખળીયા સુધી ઘાટ બાંધવાની ઈચ્છા કરી. દરબારગઢથી પશ્ચિમના કોઠાથી દક્ષિણમાં પીપળીયા ધરાની પાસે સમનિ ભૂમિ પર શ્રીહરિ બિરાજેલા છે. અને જળમાં ડુબતા બ્રાહ્મણપુત્રનું રક્ષણ કરેલું છે.

હે રાજન્ ! દાદાખાચરનું જે દુદાપરનું બીડ હતું ત્યાં શ્રીહરિ વિચરેલ છે. તે બીડમાં શ્રીહરિએ પોતાના ભક્તોને સમાધિ કરાવી પોતાનું અદભુત ઐશ્વર્ય બતાવ્યું હતું. ઉન્મત્તગંગાની ઉત્તરમાં સોમા નામે નદી રહેલી છે. જે ઠેકાણે પીપળ ગામનો માર્ગ નીકળેલો છે ત્યાં ઉન્મત ગંગાના કિનારે ઓરીયો છે તેની પાસેની સર્વ જમીન દાદાખાચરે ભાદરવા સુદ જળજીવણી એકાદશીને દિવસે ગોપીનાથજી મહારાજના થાળમાં અર્પણ કરી છે જે હાલ ભક્તિભાગ નામે પ્રસિદ્ધ છે. જ્યારે જમીન આપી ત્યારે સર્વસંતસમાજ, પાર્ષદવર્ગ અને અન્ય સર્વ ભક્તોએ સહિત શ્રીહરિએ મોટો મહોત્સવ કર્યો છે, પાલખીમાં બાળમુકુંદને પધરાવી, વાજુંત્રો

વગડાતા થકા ઉન્મત્તગંગા પ્રતિ ગયા. ત્યાં જઈ બાળમુકુંદલાલજીને નાના શણગારેલા વહાણમાં પધરાવી મહોપચારથી વિધિપૂર્વક પૂજન કરી આરતી કરી હતી. આમ તે જળજીવળીના મહોત્સવમાં માણસોની ખૂબજ ભીડ થઈ હતી. આમ મોટો ઉત્સવ ઉજવ્યો હતો. પછી શ્રીહરિ તે ઓરીયાથી દક્ષિણમાં રહેલા ઊંચા સ્થાને જ્યાં નવું મકાન કરેલું છે ત્યાં આસન ઉપર બિરાજ્યા છે, તે કૂવાની આજુબાજુની સમગ્ર ભૂમિ શ્રીહરિના ચરણોથી અંકિત થયેલી અતિપવિત્ર છે. અને હાલ ભક્તિભાગમાં મોટો કૂવો છે ત્યાં પણ પ્રભુશ્રીહરિ અનેક વાર બિરાજ્યા છે. અને હાલ બંગલો છે તેની આગળ, પડખે અને પાછળના ચોકમાં પણ શ્રીહરિ બિરાજ્યા છે. આગળ ઓરડી જે પાર્ષદોને રહેવાની છે તેમાં પણ બિરાજ્યા છે. અને ભક્તિભાગથી પૂર્વમાં



એક નાની નદી(સરવાણી) છે તેમાં પણ શ્રીહરિપ્રભુ સ્નાન કરી બિરાજ્યા છે. અને સંતોની અષ્ટાંગ યોગક્રિયાની પરીક્ષા કરી છે. ભક્તિભાગથી દક્ષિણમાં નદીના તટ પર દાદાખાચરનો બગીચો છે, તેમાં શ્રીહરિ બિરાજ્યા છે. પછી ઘનતેરશને દિવસે દિવ્યલીલા કરી હતી. તે સ્થાનથી પૂર્વદિશામાં નદીને કિનારે કૂવો છે, તેનાથી પૂર્વમાં બીજો કૂવો છે. તે બંને કૂવા પ્રસાદીના છે. તે કુવાથી પૂર્વમાં ત્રીજો કૂવો (ઓરીયો)છે તે પણ પ્રસાદીનો છે. તે ઓરીયાથી પૂર્વમાં વિશાળ સ્થળમાં ઈચ્છારામજી મહારાજના

દેહનો અંતિમ સંસ્કાર કરેલો છે. અને બીજા મોટા સંતોના દેહસંસ્કારો પણ તે જ જગ્યાએ કરેલા છે. સ્મૃતિ માટે હાલ ઓટાઓ છે તે સ્થળથી પૂર્વમાં સોમા નામે નાની નદીના કિનારા પર શ્રીહરિપ્રભુએ કૂવો ખોદાવ્યો છે. તે જગ્યા પવિત્ર પ્રસાદીની છે. તે સ્થાનથી પૂર્વમાં ક્ષીહરિએ આંબાના ઝાડ રોપાવ્યા હતા. વળી ત્યાં રામદાસભાઈ અને સ્વરૂપાનંદસ્વામી એ બંને સદ્ગુરુઓના દેહનો સવિધ સંસ્કાર કરેલો છે. અને ત્યાં પ્રભુએ કહ્યું કે :- હે ભક્તજનો ! આ સ્થળનું માહાત્મ્ય અધિક થશે કારણ કે મારા

અવતારોની સમાન ચરિત્ર અને ગુણોવાળા આ બંને સંતો મને અતિવહાલા હતા. જ્યારે સૂર્ય ઉદય પામે ત્યારે ચંદ્રનું તેજ લીન રહે છે તેમ મારા પ્રતાપથી બંને આ સેતોનું ઐશ્વર્ય લીન રહેલું હતું. માટે પૃથ્વીમાં શર ભેશ્વર

મહાદેવ અને નૃસિંહભગવાનનું પોતાની હયાતીમાં જ જેમ એમ આ બંને સંતોનું માહાત્મ્ય સૌથી અધિક હતું અને હવે પછી વિશેષ વૃદ્ધિ પામશે. આ વાત સાંભળી ભક્તજનો હર્ષ પામ્યા. તે સ્થળથી ઉત્તરદિશામાં ખીજડાનું વૃક્ષ હતું તેની નીચે પાર્ષદો માટે પર્ણકુટી કરાવી હતી. તેમાં શ્રીહરિ પંદર દિવસ નિવાસ કરીને રહેલા હતા. તે પર્ણકુટીથી પૂર્વમાં શ્રીહરિપ્રભુ અશ્વ ખેલવતા હતા. ॥૨૫॥

## બ્રહ્મરાક્ષસ - ૧૨

સ. પુરાણી સ્વામી કૃષ્ણસેવાદાસજી - ગઢડા

ગતાંકથી શરૂ :-

તો વાત વાતમાં જ બ્રહ્મરાક્ષસ આવીને ઉભો રહ્યો: અને આ વખતે જાતિ સ્વભાવને અનુસરી એકાદ ઝાડની તીરખી લાવી સ્વામીના ઉપર ઝાપટી.

સ્વામીએ યોગભળે ફેંકેલ તીરખીને અધ્ધર ત્રિશંકુની જેમ લટકાવી રાખી: અને હાક મારી:

‘ મહાપાપના યોગે તું આવી અધોગતિને પામ્યો છો આવો વિદ્વાન છો આવો કુલિન છો, કુલિનતા અને વિદ્વતા પામ્યાનું શું આ ફળ ? ભણી ભણીને પણ અંતે ઘશાવાસ્ય શ્રુતિને જ ભુલ્યો ? દેખી પેખી દીવો ઝાલીને કુવામાં ઉતર્યો ? પાપાત્મા, તે કેંક નિર્દોષોનાં પ્રાણ હર્યા છેવટે આશાભર્યા અભ્રવર્ષા બ્રાહ્મણ - બાળકને પણ ભરખ્યો: ફિટકાર છે તને ! ધિકકાર છે તારી કુલ જાતિને ! છેવટે આ ઝાડની ડાળી ફેંકી સન્તનો પણ દ્રોહ કર્યો: હજુ આ ને આ જાતિમાં સડવું છે કે ઉધ્ધરવું છે ? પાપના કીચડમાં આમને આમ રગદોળાવું છે ? ઉગરવું છે ? બોલ જલદી બોલ ઉત્તમ બ્રહ્મ કુળમાં જન્મી શું કમાણી સાધી ? તારી વિદ્યા, તારૂં બ્રહ્મજ્ઞાન તારા મોક્ષના સાધનમાં ખપ ન લાગ્યાં તો તે વિદ્યાથી શું ? અને જ્ઞાનથી પણ શું ?

લાલચોળ બની જઈ યોગીવરે હિતસ્વી વેણની ઝડી વરસાવી.

ત્યાં તો મોટો સાદ કાઠી નાનું બાળક રડે તેમ બ્રહ્મરાક્ષસ રડવા લાગ્યો. રાક્ષસની

ઉભય આંખમાંથી શ્રાવણ ભાદરવાના સરવડાં વરસવા માંડ્યાં ! જાણે સ્વામીના દર્શન માત્રથી રાક્ષસનું પાપ અશ્વરૂપ બની ચાલી નિકળતું હોય નહિં શું ?

‘ બ્રહ્મરાક્ષસ; રોમાં રોમાં: મનુષ્ય માત્ર ભુલને પાત્ર છે. પણ એ ભુલને સુધારવી એ માનવ જીવનનું પરમ કર્તવ્ય છે: ઠીક હવે કહે જોઈ: આ સ્થિતિમાં શી રીતે આવ્યો ? સ્વામીએ કહ્યું.

‘ મહાભાગ, સાંભળો મારી ગૃહિણી અને મારો પુત્ર આ સામેની તેલની કોઠીમાં પડીને મુઆં: હું પણ મોહવશ બની પાછળ પડીને મુઓ : આથી મારી આ સ્થિતિ થઈ છે: હવે કૃપાળું, કરૂણા કરો: અને મારો ઉધ્ધાર કરો: હું બહું આ ગતિમાં રીબાઈ છું : મુંઝાઉ છું : મારે નથી ખાવાનું સુખ: નથી પીવાનું સુખ: મેં કેંક નિર્દોષોના પ્રાણ લીધા છે: એ બધું મને હવે કાંટાની જેમ શરીરમાં ખુરચા કરે છે !

‘ મુખા, જેટલો સ્નેહ તેટલું દુખ: હોલી અને હોલીનાં બચ્ચામાં સ્નેહ રાખવાથી હોલો પણ પારાધિની જાળમાં જકડાયો એ શું તું પંડિત થઈને વિસરી ગયો !

એ અવધુત ગીતા અને એકાદશ સ્કંધ આચરણમાં જરા પણ ન મુકી શક્યો ? પંડિતાઈ જ પંડિતને બેડીરૂપ બને છે: જેટલો સ્નેહ તેટલું દુખ: જો આ દીપકમાં સ્નેહ છે (તેલ છે) ત્યાં સુધી

(વધુ આવતા અંકે)

## વૃક્ષમાંથી વારસદાર

રજુ - એ.ડી.સાવલીયા-પીઠવડી

સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ પહેલા ઘણો જ પ્રબળ હતો. તે દિવસે સંપ્રદાયની શોભા ધન વૈભવથી માપવામાં નહોતી આવી વ્યવહાર ગોણ હતો. વર્તન પ્રધાન હતુ સોનાના ચળકાટથી નહી પરંતુ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાનની ઝળહળતી જ્યોત લોકોની આખો ને આંજી દેતી હતી. તેમાં પણ સોરઠ પ્રદેશમાં જુનાગઢ મંદિરના મહંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મહારાજના મંદિરની બળભરી વાતો અને એમના શુદ્ધ વર્તનથી લોકો અજબ રીતે આકર્ષાયેલા રહેતા.

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરએ ભગવાન સ્વામિનારાયણ ની સર્વોપરિ ઉપાસનાના અખાડાનું કેન્દ્ર બન્યું હતું જુનાગઢના સભામંડપમાંથી રાત્રી દિવસ કથાવાર્તાના અખંડ પ્રવાહો વહેતા અને ત્યાગ વૈરાગ્ય અને બ્રહ્મચર્યની છોળો ઉછળતી.

સાથ સારા સમજુ સત્સંગીઓ સ્વામીને ઉપદેશ શૈલી એવી ચોડદાર હતી કે સાંભળનારના સંકલ્પો બંધ થઈ જતા. નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થતી લોકો છતે દેહે બ્રહ્મરૂપ થઈ જતા મુમુક્ષુના મનમાં ગુચવાતા અનેક પ્રશ્નોનું સમાધાન સ્વામીની વાતો સાંભળતા સાંભળતા આપો આપ થઈ જતું ન કેવળ હિંદુઓ, મુસલમાનોને પણ સ્વામી પ્રત્યે અનેરો પૂજ્યભાવ હતો જુનાગઢ ના નામદાર સાહેબ, દિવાન બહાઉદીનજી માણાવદર અને માગરોળની નવાબો પણ અવાર નવાર સ્વામીના દર્શન કરવા અને વાતો સાંભળવા આવતા તેમજ જુનાગઢના નાગર સદગૃહસ્થો અને દેશ દેશાંતરના ગિરાસદારો,

રાજમહારાજઓ, શ્રીમંતો, શાહકારો અને અન્ય હરિભક્તો ખેચાઈ ખેચાઈને સ્વામિનો સમાગમ કરવા આવતા.

સ્વામીની સ્થિતિ એથી અમોઘ અને અમાપહતિ કે કોઈ તેને કળી શકે નહિ જ્ઞાન ધ્યાનની છોળ્યો ઉછાળી સ્વામીએ સત્સંગના બગીચાને નવપલીન રાખ્યો મહારાજ ના મહિમાની બળભરી વાતો કરી સંતો અને સત્સંગીઓમાં અજબ જુસ્સો પ્રેર્યો સ્વામીના વચને સત્સંગીઓએ સત્સંગ અર્થે તન, મન, ધન કુરબાન કર્યા.

જુનાગઢના મંદિરના સેવા કાર્યમાંથી સમય કાઢી સ્વામી સત્સંગીઓ ને સુખદેવાને અર્થે ફરતા રહેતા અને જીવોના અંતર બહારના સંતાપ ટાળી શાંતિ આપતા આવા ગુણનિધ ગુણાતીતાનંદ સ્વામીનો અદભુત પ્રસંગ છે.

ગરવા ગીરનાર ઘાટા જંગલોની પડખામાં કાલસરી નામે એક ગામ આવેલું છે ગામના પાદરમાં વાકી ચુકી અથડાતી પછડાતી ધુધવાટા કરતી પોપટડી નામની નદી વહે છે ગામમાં થોડા ઘણા સત્સંગીઓના ઘર છે ભગવાન સ્વામિનારાયણનું સુંદર મંદિર છે.

કાલસારીના એક તાવિક ભક્તે જુનાગઢ રાધારમણ દેવને એક ખેતર કૃષ્ણાર્પણ કરેલું આ ખેતરની સંભાળ રાખવા તથા કામ કરવા માટે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીએ ડુંગર ભક્તને અહીં મુક્યા હતા. ભગત શ્રીજી મહારાજના ખુબ હેતવાળા હતા. અને તેનું દિલ સત્સંગના રંગથી રંગાયેલું હતું પાસે બેસનાર માનવી ને મહારાજના

મહિમાની તથા શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવાની વાતો હેતુ પૂર્વક કરતા હતા. આ ભક્તની વાતોથી કેટલાક કોળી ભાઈઓના જીવન સત્સંગના રંગે રંગાયા અને તે બધા પંચ વર્તમાન દ્રઢ પણ પાળનારા થયાં તેવામાં પંચાળા ગામથી કેટલાક લુવાણા સત્સંગી ભાઈઓ ડાલસા રહેવા આવ્યા જેથી આ નવા થયેલા સત્સંગીઓને સારો સાથ મળ્યો. બધા સાંજે એક ઠેકાણે ભેગા થાય આર્તી ધુન્ય કરે અને કથા વાર્તા કરી અને કીર્તનોની રમંઝડ બોલાવે જેથી બીજા પણ કેટલાક આ જોઈને સત્સંગમાં ખેચવા લાગ્યા ધીમે ધીમે કેટલાક પટેલીયાઓ પણ સત્સંગી થયા.

એક વખત ગુણાતીતાનંદ સ્વામી કાલસાડી પધાર્યા સત્સંગીઓના આનંદનો પાર ન રહ્યો પાર્ષદ ડુંગરભગત તો પ્રેમમાં ગાંડા બની ગયા સ્વામીને આનંદ કરી બે દિવસ રોક્યા બધાએ સ્વામીની વાતો સંભળી ખૂબ હાવો લિધો બીજે દિવસે સ્વામી તથા સંતો નદીમાં સ્નાન કરવા પધાર્યા નદીમાં નાહીને મંદિરનું ખેતર હતું તે જોવા માટે સ્વામી ગયા ખેતરમાં સરસ બાજરો ઉભો હતો. તેનો પોક પાડી ઠાકોરજીને ઘરાવ્યો પછી સ્વામીએ બધા સંતોને તથા સત્સંગીઓને પોકનો પ્રસાદ આપ્યો.

આ વખતે ડુંગર ભગતે સ્વામીને નમસ્કાર કરી કહ્યું કે સ્વામી ? આ ગોવીંદભાઈ કોળી ઘણા સારા સત્સંગી છે આપણા ખેતરમાં તેઓ સેવા ભાવથી કામ કર્યા કરે છે પોતાના ખેતરનું કામ છોડીને પણ અહિં સેવા કરે છે તેઓની પંચાવન વર્ષની ઉંમર છે પણ દિકરો નથી તો તેના ઉપર દયા કરો જેથી તેમને દિકરો થાય

સ્વામી જરા હસ્યા અને કહ્યું કે ભગત

! આ ટીંબકવાનું મોટું જાડ છે તેને વર્તમાન ઘરાવીને કાપી નાખીએ મહારાજ ગોવિંદ ઉપર દયા કરે અને જાડમાં જે જીવ છે તે ભક્તને ઘેર દિકરો થાય. ચાલો, લાવો પાણી એમ કહી સ્વામીએ જાડને વર્તમાન ઘરાવ્યા સત્સંગીઓએ તે જાડ કાપી નાખ્યું અને તેને સીધું મોટું લાકડું ગામમાં લાવ્યા ગોવિંદ ભગતે પોતાના બળદિયા બાંધવાનો ફરજો કર્યો હતો તેમાં તે લાકડું રાખ્યું ત્યારબાદ સ્વામિ જુનાગઢ પધાર્યા.

સ્વામીની કૃપાથી બરાબર દસ મહીને કોળી ભગતને ત્યાં પુત્રનો જન્મ થયો ગોવિંદભગતના આનંદનો પાર ન રહ્યો દીકરાનાં જન્મ પ્રસંગે દીકરાનું નામ ભીમ રાખ્યું ભીમભાઈ મોટા થતા ખૂબ સારા સત્સંગી થયા કાલસારીના બધા ભક્તોએ મળી ગામમાં એક સાડું મંદિર બનાવ્યું પેલું ટીંબરવાનું લાકડું હતું તે મંદિરમાં પાટડા તરીકે ગોઠવ્યું

ભીમા ભગત નિયમીત મંદિરે આવે શ્રીજી મહારાજની મુર્તી પાસે એક પગે ઉભા રહી માળા ફેરવે અને બોલે જીવડા જોને તારો દેહ તો જડ જાડવાનો હતો પણ મોટા પુરૂષે દયા કરીને તને માણસ બનાવ્યો છે હવે તું માયિક પદાર્થમાથી વૃત્તિ પાછી વાળીને ભગવાનમાં જોડી દે નહિંતર તારે પાછા આવા અનંત શરીરો ધરવા પડશે આમ પોતાના અંતરાત્માને ઉપદેશ આપતા જાય અને માળા ફેરવતા જાય મહા પ્રભુની પ્રાર્થના કરતા જાય.

નિર્મળ અંતઃકરણવાળા અને શુદ્ધ વર્તમાનવાળા આ ભક્ત આખી જીંદગી એક રહેણી કહેણીથી રહ્યા પોતે કોળી હોવા છતા સત્સંગના પંચવર્તમાનના નિયમ પાળી અને જેને જેને ભગતનો સહવાસ થયો તેઓ પણ સારા સત્સંગી

બન્યા ભગતના યોગથી કાલસારીમાં કોળી ની જ્ઞાતિમાં સત્સંગન ખૂબ સારો રંગ ચડ્યો.

જુના જમાનામાં રાજ્યો તરફ થી ગામને ચોરે રાતના બાર એક વાગ્યો નગાર, વગાડવામાં આવતું આ નગાર, વાગે ત્યારે ગામમાં જે જે ચોરી કરનાર માણસ હોય તે બધા ચોરે આવે અને ત્યાં તેમની હાજરી પુરાય કાલસારી ગામમાં પણ નગાર વાગતું અને શકદારો ભેગા થતા પણ મોટે ભાગે આ શકદારોમાં કોળીજ્ઞાતીમાંથી કોઈ ન હોય એક વખત હાજરી તપાસનાર મામલતદારે પોલીસ પટેલને પુછ્યું કે આ ગામમાં કોળીની વસ્તી ઘણી છે પણ શકદાર કરીકે એક પણ કોળીનું નામ કેમ દેખાતું નથી ? ત્યારે પોલીસ પટેલને કહ્યું કે સાહેબ અમારા ગામના કોળી લોકો ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છે જેથી ચોરી કે ખોટું કામ કોઈ દિવસ કરતા ન નથી એ સાંભળીને સાહેબ ખૂબ રાજી થયા.

ભક્તો ! કહેવાનો ભાવાર્થ એ કે ભગવાન અને મહાપુરુષો ધારે તે કરે ઝાડમાંથી મનુષ્ય બનાવે પારસમણિનો સ્પર્શ થતાં લોટું સોનું થઈ જાય તેમ શ્રીહરિના આ મહાન સંતોના યોગમાં આવનાર જીવો બ્રહ્મરૂપ થઈ જાય, ચોરી અને લુટ ફાટ કરનારા તરીકે પંકાયેલ લોકો ભાગડી મટી ભગત બની જાય, આ કાંઈ નાની સુની વાત નથી

ગુણાતીતાનંદ સ્વામીના પ્રબળ પ્રતાપના પુરાવા રૂપ અને ભીમાભગતની પવિત્ર યાદીરૂપ આ પાટડો આજે પણ કાલસાકી મંદિરમાં મોજુદ છે.

(અનસધાન પાના નં. ૯ નુ શરૂ)

તમે તો અજ્ઞદાતા કહેવાય, અનેકના પાલનદારનું તમને બિરૂદ મળે છે. માટે તમો ધારો તે કરી શકવા સમર્થ છો, ધારો તો તારો, અને ધારો તો મારો,”

આટલી નીચી કક્ષાના માણસની આવી સ્પષ્ટ અને બેધડક વાત સાંભળીને રાજાને થયું કે, આ વાતમાં તથ્ય છે. એટલે તેમણે કામદારને પૂછ્યું, “આ વાત પૂછતા તને ડર ન લાગ્યો ?” કામદાર કહે “નામદાર, આપણે સૌ એક જ ભગવાનના સંતાન છીએ. હું દરરોજ સવારે ઊઠીને પ્રથમ મારા ઈષ્ટદેવને યાદ કરું છું. તેની માનસી પૂજા કરું છું મને સદા તેમના સાથનો અહેસાસ થાય છે. અત્યારે મેં આ જે કંઈ કહ્યું તે તેના જ આધારે કહ્યું છે. ભગવાન જેવા સમર્થનો સાથ હોય પછી ડર શાનો ?” આ સાંભળી રાજા ખુશ ખુશ થયો. અને ફાંસીની સજા માફ કરી, મોટું ઈનામ આપ્યું. રાજાએ પણ માનસી પૂજા કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.

કહેવત છે ને કે, “રાજાનો ધર્મ તે જ પ્રજાનો ધર્મ” રાજાના નિશ્ચય મુજબ પ્રજાએ પણ નિયમ લીધો. અને બધા ખુબ સુખી થયા.

નિત્ય સવારે ઊઠીને માનસી પૂજા દ્વારા ભગવાન દર્શન કરનારને કોઈ દિવસ અપશુકન થતાં નથી. આમ માનવ કલ્યાણને માટે ભગવાને જે કંઈ શિક્ષાપત્રી દ્વારા કહ્યું છે. તે જીવનમાં ઉતારવાથી સદા સુખ-શાંતિ મળે છે. આવા નાના માણસને પણ ભગવાનનો દૃઢ નિશ્ચય થયો, તો તે નિડર બની ગયો. ને પોતાનું જીવન બચાવ્યું. ઉપરાંત મોટી બક્ષીસ પણ મેળવી. તેના દ્વારા તેનું દારિદ્ર ગયું અને મહા સુખીયો થયો.

# અંતરના અવાજને ઓળખો

લેખક :- ગુણવંત એમ. ખાટસુરીયા-ગઢડા (સ્વા.)

સંવત ૧૮૮૨ના મહાસુદ-૫ વસંત પંચમીના દિવસે શ્રીજી મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી છે. તે માત્ર સંપ્રદાયના માણસો માટે જ છે. એમ ઘણાં માને છે. પરંતુ તેવું નથી. સમગ્ર માનવ જાતના કલ્યાણ અર્થે લખી છે. ભગવાને કહ્યું છે કે, “અને અમારા સત્સંગી તેમણે, નિત્યે સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું, અને શ્રીકૃષ્ણ ભગવાનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું (૪૯)” આ શ્લોકની વાતને એક દૃષ્ટાંત દ્વારા સમજીએ

એક રાજા હતો. તે ધાર્મિક વૃત્તિનો હતો. એક દિવસ તેને અગત્યના કામ અંગે બહાર જવાનું હતું તેથી સવારમાં વહેલો ઊઠી નિત્યકર્મ પરવારીને પોતાના રસાલા સાથે નિકળી પડ્યો. આખા દિવસની રઝળપાટ પછી પણ કામ થયું નહિ. થાકીને તે સાંજે મહેલમાં પાછો ફર્યો. તે વિચાર કરવા લાગ્યો કે, “આજે સવારે મેં કોનું મોઢું જોયેલું કે મને આજના કામમાં સફળતા મળી નહિ ?” ખુબ વિચાર કરતા તેને યાદ અવ્યું કે સવારે ઝરૂખાની બારી ખોલતા સફાઈ કામદારનું મોઢું જોયેલું. તેથી મને અપશુકન થયા ને કામ થયું નહિ.

બીજે દિવસે તેણે સવારમાં સભા ભરી તે સફાઈ કામદારને બોલાવ્યો અને કહ્યું તું અપશુકનીયાળ છે. કાલે સવારે તારું મોઢું જોયું તેથી આખો દિવસ મારો નકામો ગયો, મારું કામ થયું નહિ, માટે તારા જેવા અપશુકનીયાળને જીવવાનો કોઈ અધિકાર નથી. માટે તને ફાંસીની સજા કરવામાં આવે છે.” આ સાંભળીને કામદારતો એકદમ ડઘાઈ જ ગયો. શું કહેવું ?

શું કરવું તે તરત સુજયું નહિ, પણ તે ધાર્મિકવૃત્તિનો હતો. તેથી તેણે ધીરજ ગુમાવિ નહી, નિત્ય નિયમ, પ્રભુસ્મરણ, સ્વધર્મ પાલનમય તેનું જીવન હતું તેથી તેણે તરત પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા. અંદરથી પ્રેરણા મળી, તે મુજબ તેણે વિચાર્યું કે, “આ તો રાજા, વાની અને વાંદરા ! ત્રણેય કાચા કાનના કહેવાય, જે હું કંઈ નહીં બોલું તો તે મને જરૂર ફાંસીએ ચડાવશે, આમ પણ મરવાનું તો છેજ ! તો પછી અંદરના અવાજને સમજીને જે ભગવાન બોલાવે તે રજુઆત કરવી.” આમ વિચારી તેણે કહ્યું, “મારો અપરાધ થાય તો ક્ષમા કરશો, પણ હું કંઈક કહેવા માગું છું. જે આપની આજ્ઞા હોય તો કહું.” રાજા પણ ધાર્મિકવૃત્તિનો હતો. તેથી વાત સાંભળવા તૈયારી બતાવી ત્યારે તે કામદાર બોલ્યો, “આપ મને અપશુકનીયાળ કહો છો. તો તે બાબતમાં હું કહુ છું કે તમે મારું મોઢું જોયું તો તમારું કામ થયું નહીં, તે કામ તો આજે કે હવે પછી પણ થશે. પણ મને તો તમારું મોઢું જોઈને ફાંસીની સજા થઈ તો મારું તો જીવન જ સમાપ્ત થઈ જશે. પછી મારા માટે શું બાકી રહેશે ? મારી એક વાતનો જવાબ આપીને પછી મને ખુશીથી ફાંસીએ ચડાવી દેજો, આપણાં બે માં વધારે અપશુકનીયાળ કોણ ? કોને વધારે અપશુકન થયા ? મારું મોઢું જોવાથી તમારું કામ ન થયું અને તમારું મોઢું જોવાથી મને ફાંસીની સજા થઈ માટે વધારે અપશુકનીયાળ કોણ ? તે જવાબ આપવા વિનંતી છે. તે જવાબ આપીને પછી ભલે મને ખુશીથી ફાંસીએ લટકાવી દેજો.

(અનસંધાન પાના નં. ૮ પર)

# ભક્તરાજ દરબારશ્રી દાદાખાચરનું જીવન ચરિત્ર

ગતાંકથી શરૂ :-

એન.કે.વેકરીયા

પણ રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, દાદાખાચર અને એમના ઘરનાં મનુષ્યો તેમણે કોઈ દિવસ અમારા વચન માં સંશય કર્યો નથી. એવા નિઃસંશય ભક્તોની ભક્તિ ને વશ થઈને જ અમે આંહી ટક્યા છીએ એમણે ઘરબાર, ગરાસ, સર્વે અમારા પરાયણ કરી મેલ્યા છે અને દાદાખાચર, તો આત્મનિવેદી છે તે ઠાકોરજી ને ઘરીને પાણી પીયે છે. આત્મનિવેદી હોય તેના હાથની રસોઈ જમે માટે અમે એમના ઘેર રહ્યા છીએ દિવ્ય અક્ષર ધામમાંથી ઉતરી આવી દાદાખાચરના ગાર માટીના ઘરમાં રહ્યા છીએ.

મહારાજ દાદાખાચરની આવીતો ઘણીવાર આકરી કસોટી કરતા પણ સોનાને જેમ જેમ તપાવો તેમ તેમ વધુને વધુ ચળકતુ થાય, અને ચંદનને વધુને વધુ ઘસો તેમ વધુને વધુ સુંગધી થતુ જાય તેમ ભક્તરાજની વધુને વધુ કસોટી થતી જાય તેમ ભક્તજનની ભક્તિ અને પ્રભુ પ્રેમ વધુને વધુ આગળ વધતા જ જાય.

એકવાર શ્રીજી મહારાજે દાદાખાચરને કહ્યું જે આ તમારો ગરાસ તમારી બે બેનોને લખી આપો ત્યારે દાદાખાચર કહે બહુ સાડ મહારાજ પછી પોતાના કારભારી લાઘાઠક્કરને બોલાવી ગરાસ, મોટીબા, લાડુંબાને લખી આપ્યો

ને દાદાખાચરે સહી કરી દીધી પછી મહારાજ કહે દાદાખાચર, તમે હવે શું ખાશો ? ત્યારે દાદાખાચર કહે કે ભાવનગર જઈને વજેસિંહજીનો લેખ લખાવી આ ગઢડામાં ચાકર રહીશ તે એ મને વરસદીના એક સો રૂપિયા આપશે. તેમા અમે બે જણા નિભાવ કરીશું ત્યારે મહારાજ કહે ભાવનગર જઈ લેખ લખાવી લાવો પછી દાદાખાચરે ઘોડે

ચડી ભાવનગર જવા ચાલ્યા ત્યારે મહારાજે લાડુંબા તથા જીવુબાને કહ્યું આ તમારા ગરાસનું કામકાજ કોણ કરશે ? ત્યારે બહેનો કહે કોઈ માણસ રાખી આપજો પછી મહારાજ કહે આ દાદાખાચરને ચાકર રાખો એટલે તે તમારૂં કામ બહું સાડ કરશે વરસ દિવસ ના સો રૂપિયા પગારના આપજો એનો પણ નિભાવ થશે ત્યારે જીવુબા તથા લાડુબા



બોલ્યા જે હે મહારાજ એમ કરો પછી દાદાખાચરને પાછા વાળ્યા વરસ દિવસના સો રૂપિયા આપવા ઠેરાવી લેખ કરી આપ્યો પછી બાર મહીના સુધી આ ગરાસ ની ઉપજ એ બહેનો એ ખાધી પછી બીજુ વરસ આવ્યું ત્યારે મહારાજે એ બેય બહેનોને કહ્યું જે તમે સાંખ્યયોગી બાઈઓ તે તમારે આ ગરાસની કડાકુડ શા સાડ કરવી જોઈએ ? માટે દાદા ખાચરને પાછો આપો ત્યારે તે બહેનો કહે, બહુ સાડ મહારાજ પછી એમ

ગરાસ દાદાખાચરને પાછો આપ્યો એવી રીતે મહારાજે દાદાખાચરનું અંગ જોયું ને બહુ રાજી થયા.

એકવાર શ્રીજી મહારાજ ઘેલામાં ન્હાવા પધાર્યા હતા. ત્યાં કોઈ તીર્થવાસી સાધુ એ નદિ ને કાંઠે રસોઈ કરતો હતો તે કુકી કુંકીને બળતું કરે ત્યા વરસાદના છાંટા આવે તે બળતું ઓલાઈ જાય તે જોઈને મહારાજે જીવા ખાચરને કહ્યું જે આ તીર્થવાસીને ઉતરવાની જગ્યા ક્યાઈ કે કરાવો તો સાડ એ બહુ દુઃખી થાય છે ત્યારે જીવા ખાચર કહે એવા તો ઘણા રજાળતા ફરે છે માટે એની સાડ કોણ જગ્યા કરાવે ? પછી મહારાજ નાહીને આવીને દાદાખાચરના દરબારમાં સભા કરીને બીરાજમાન થયા ત્યારે દાદાખાચરને મહારાજે કહ્યું જે આજ અમે નદીએ નાવા ગયા હતા. ત્યા એક તીર્થવાસી નદીને કાંઠે રસોઈ કરતો હતો તેને છાંટાથી બળતું વારે વારે ઓલાઈ જતું હતું તો એવાતીર્થવાસી રાંધી ખાય એવી જગ્યા ક્યાય છે ? ત્યારે દાદાખાચર કહે આ મારો રહેણાંકનો ઓરડો તીર્થવાસીને રાંધી ખાવા સાડ રાખો ત્યારે મહારાજ કહે તમે અને તમારા ઘરના મનુષ્ય ક્યા રહેશો ? ત્યારે દાદાખાચર કહે હું સાધુ ભેગો રહીશ અને મારા ઘરનું મનુષ્ય જીવુબા ભેગા રહેશે. એવુ દાદાખાચરનું વચન સાંભળી જીવા ખાચર સામું જોઈને મહારાજ બોલ્યા જે જુઓ જીવા ખાચર તમને મે કહ્યું ત્યારે કેવો ઉતર આપ્યો અને દાદાખાચરે કેવો ઉતર આપ્યો ? પોતાને રહેવાનો ઓરડો અમારે વચને કરીને આપવા માંડયા માટે આવા દાદાખાચરના ગુણ જોઈ ને અમે તેને ત્યા રહ્યા છીએ એમ જીવાખાચર ને શ્રીજી મહારાજે કહ્યું

જીવાખાચર વારંવાર શ્રીજી મહારાજ ને કહ્યા કરતા કે હે મહારાજ તમે દાદાખાચર તરફ પક્ષપાત રાખો છો તે મહારાજે બતાવી દીધું કે શા સાડ પોતે દાદાખાચર તરફ પક્ષપાત રાખે છે.

વળી મહારાજે એકવાર તો બહુજ આકરી કસોટી લીધી એકવાર શ્રીજી મહારાજ કહે દાદાખાચર સાચો ભક્ત કોને કહેવાય ? દાદાખાચર કહે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરીદે તે જ સાચો ભક્ત ત્યારે મહારાજ કહે તો આ તમારા ગામ ગરાસ, દરબારગઢ, ધન દોલત બધુજ અમને લખીદો દાદાખાચરે તો એજ ઘડીએ પોતાના કારભારી હરજી ઠક્કરને બોલાવી બધુ મહારાજને અર્પણ કરી દીધું અને કાગળ કરી લીધો પછી મહારાજ કહે હવે તમે તો આ બધુ અમને અર્પણ કરી દીધું છે માટે તમારા થી અહીં ન રહેવાય અને અહીંથી કશુંય ઉપયોગમાં પણ ન લેવાય એ બધુ તો તમે અમને અર્પણ કરી દીધુ એ માટે હવે તમે બધાજ પહેરે લુગડે આ દરબાર ગઢમાં થી બારા નીકળી જાઓ.

પછી તો દાદાખાચર, જીવુબા, લાકુબા, ઈત્યાદિ સર્વ દરબારગઢમાંથી નીકળી પગે ચાલીને ગામ બહાર ગયા અને ત્યાંથી ગોખલાણા ગામે જઈને રહ્યા ગોખલાણા ગામે મોટીબાનો જન્મ થયો હતો અને મોટીબાનું મોસાળ માટે ત્યાં જઈને રહ્યા રસ્તામાં ભુખ્યા, તરસ્યા, તડકાના ઉઘાડા પગે કાંટા કાકરા વાગે તોય મહારાજના વચને હાલી નીકળ્યા મનમાં મહારાજને સંભારતા જાય છે મનમાં જરાય ઉદાસીનતા નથી રાજીપેથી મહારાજની આજ્ઞા પાળવાના કેફે કપીને મહારાજનું ભજન કરતા થકા ચાલી નીકળ્યા છે. આ તો જેમ ભગવાને સત્યવાદી હરિચંદ્રની

કસોટી કરવા તેના રાજપાટ લઈને રસ્તે રજાળતા કરી મુકેલા એવી કસોટી થઈ આકરી બાણ જેવી પણ મોટીબા, દાદાખાચર વગેરેને તો મનમાંય નથી કે મહારાજ આમ કેમ કરે છે.

થોડા દિવસ એમને એમ ગયા ત્યાં મહારાજે વળી દાદાખાચર વગેરેને બોલાવ્યા સૌને એમ કે કસોટી પૂરી થઈ દાદાખાચર વગેરે આવ્યા ત્યારે મહારાજ કહે આ તમે કાગળ તો કરી દીધો પણ કાગળના ભરોસાકેટલા ક્યારેક ફાટી જાય અને નાશ પામે માટે તાંબાના પતરે બધુ લખાવી દીધું મહારાજે રોકાવાનું કંઈ કહ્યું નહીં તેથી ગોખલાણા પાછા ગયા.

એ અરસામાં લોચાથી સુરા ખાચર ગઢડા મહારાજના દર્શને આવ્યા તેમણે વાત જાણી અને મહારાજને થોડું ઘણ્યા કે મહારાજ, ભગવાન તો દયાળુ હોય અને દાદાખાચર જેવા મહાન ભક્તજનની તમે આ દશા કરી ? લોકો શું કહેશે ? પછી મહારાજ કહે તો બોલાવી લાવો સૌને પછી સુરા ખાચર સૌને ગઢડા પાછા તેડી લાવ્યા અને દાદાખાચર ના દરબારગઢમાં પહેલાની જેમ મહારાજે તેમને રહેવાની સઘળી વ્યવસ્થા કરી દીધી અને બધુ દાદાખાચરને પાછુ સોંપી દીધું કેવી શુરવીર અને લડાયક કાઠી કોમ હોય છે ? એનેય ભગવાને

કેવી પ્રેમથી વશ કરીને મુક્તની પંક્તિમાં સૌને ભેળવી દીધા આવા અતિ આજ્ઞા ધારી દાદાખાચર હતાં માટેજ ભગવાને વયનામૃતમાં દાદાખાચરના ભારોભાર વખાણ કરીને તેમની ભક્તિને બીરદાવી છે ને વયનામૃતના તો પાને પાને દાદા ખાચરનું નામ

દાદા ખાચરની એકજવૃત્તિ આજ્ઞાપાલન મહારાજનું વેણ પડ્યું નથી ને દાદાખાચરે ઝીલ્યુનથી મહારાજનું વેણ પડે પછી વિચાર કરવા થોભે ઈ દાદા ખાચર નહીં. એવા વિશ્વાસમાં અને આજ્ઞાપાલન ના અંગવાળા ટેકીલા દાદા ખાચર હતા એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં અક્ષર ઓરડીમાંથી ચાલીને લીંબતરૂતળે આવીને બોલ્યા જે દાદાખાચર ક્યાં છે ? તે વખતે દાદાખાચર દરવાજાની ટેલીમાં વતુ કરાવતા હતા તે મહારાજનો શબ્દ સાંભળીને

અધુરી હજમત રખાવી એમને એમ મહારાજ પાસે આવીને હાથ જોડી ઉભા રહ્યા ત્યારે સામુ જોઈને મહારાજ કહે કેમ વતુ અધુર છે ? ત્યારે દાદાખાચર કહે મહારાજ તમે સાદ કર્યો તેથી વતુ બંધ રખાવીને આંહી આવ્યો તે જોઈને મહારાજ અતિશય રાજી થયાને બોલ્યા જે જુઓને અમારા ઉપર હેત બહુ જેથી અરદે વતે દોડયા આવ્યા આવાપ્રેમ અને મહીમા વાળા છે તેથી અમે તેના ગરાસનું કામ તથા વાડી ખેતર વગેરેનો



વ્યવહાર કરીએ છીએ અને વશ થયા છીએ.

અને ખરેખર શ્રીજી મહારાજ દાદાખાચરના પ્રેમને વશ થઈ તેના ઘરના કામો પણ ઉકેલતાજ અને દાદાખાચરના વ્યવહારનું ધ્યાન ભરાબર રાખતાં અને દુશ્મનોથી દાદાખાચરની રક્ષા કરતા હતા.

એકવાર શ્રીજી મહારાજ ભેગા દાદાખાચર વડતાલ સમૈયો કરવા ગયા હતા તે સમૈયો કરીને પાછા ગઢપુર આવ્યા ત્યારે હરજી ઠક્કરે મહારાજને કહ્યું જે દાદાખાતર ના ખળાં જીવાખાચરે વહીવટ દારને મળીને રોકાવ્યા છે ત્યારે શ્રીજી મહારાજ ભાવનગરના ઉતારા માં જઈને વહીવટદારને મળી વાત ચીત કરીને ખળાં ઉપાડવાની રજા લઈ આવ્યા અને બાજરો ઘેર લાવીને કોઠીઓમાં ભર્યો એમ મહારાજ દાદાખાચરનો વહીવટ સાંચવતા.

એક સમયે શ્રીજી મહારાજ દાદાખાચર ના દરબારમાં બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સંત હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને તે માધમાસ હતો તે વખતે વરસાદના ઝીણા ઝીણા છાટા પડવા લાગ્યા ત્યારે મહારાજ કહે ખળામાં દાણા બગડી જશે માટે ટાંકવા સૌ સંત પાર્ષદ જઈએ એમ કહીને મહારાજ પોતે ઉઠ્યાને ઓખાઈ મોજડીઓ ભગુજી પાસે મંગાવીને પહેરીને બાંધીને કાળી કામળી ઓઢીને મહારાજ ચાલ્યા ત્યારે સૌ પાછળ ચાલ્યાને મહારાજ ચાલે તે પાછીમાં મોજડી ઓના છમ છમ અવાજ થાતા જાય એમ કરતા ભક્તિબાગથી આથમણી હાલમાં જે દરબારી ફુલવાડી છે ત્યાં દાણાના ખળા હતા ત્યાંગયા ને સૌને કહ્યું આ બાજરો વગેરે ભેળો કરીને ટાંકવા માંડો, ત્યારે

સૌ બોલ્યા જે હે મહારાજ તમે અહી બિરાજે અમને ટાંકી દઈએ એમ કહીને બે નાકા સામ સામા ભેળા કર્યા ને તે ઉપર જુવાર કડબ નાખીને ગાડા તળે કમોદનું પરાળ પાથર્યું તે ઉપર મહારાજ બિરાજ માન થયા તે વખતે ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો તે સાધુ વગેરે સર્વે દાણા ટાંકવા માંડ્યા તે પ્રથમ દાદાખાચરનું ખળુ ટાંક્યું ને પછી મોટીબા તથા લાડુંબાના ખળા ટાંક્યા પછી મહારાજ કહે આ પાંચુબાનું ખળુ પણ ટાંકો ત્યારેતે પણ ટાંક્યું તે પછી ઘેલા ધાધલ હરજી ઠક્કર લાધા ઠક્કરના ખળાં પણ ટાંક્યા પછી સૌ સંતો વગેરે મહારાજ પાસે આવીને બેઠા આમ શ્રીજી મહારાજ દાદાખાચરના ખેતર વાડીની સંભાળ કાળજી થી રાખતા.

દાદાખાચરના દરબારગઢમાં નિવાસ કરીને રહેલા શ્રીજી મહારાજ દરબારના ઘરના કામ કાજ ઉપર પણજાતે દેખરેખ રાખી કાળજીથી ઘરના ઘણીની જેમ ઉકેલતા અને પોતે પણ જાત મહેનત કરવામાં પણ જરાય સંકોચ રાખતા નહી. એક વખત મહારાજ અક્ષર ઓરડી માં હતા ત્યાંથી ચાખડીએ ચડીને લીંબડા તળે જઈ એક ઘડી બેઠા ને ત્યાંથી ઉગમણા બારને ઓરડે પધાર્યા ને ત્યાંથી ટોલીયા ઉપર ઉગમણે મુંખારવિંદે બિરાજ માન થયા.

(વધુ આવતા અંકે)





# અ.નિ.સ્વામીશ્રી જગત પ્રકાશદાસજીના મુખેથી “રત્નકણીકા”

લે.લાલજીભાઈ એ.સાજણાવાવ



ગતાકથા ચાલુ

૨૧. કુલ સોયથી વિંધાવા સતા બીજની સોભાને ખાતર પોતાને ધન્ય માને છે વૃક્ષ પોતાના ફળ બીજને ખવડાવીને ખુશથાય છે નદિ તરસ્યાને તૃષા મીટાવવા માટે અથડાતી અથડાતી આગળ વધે છે જ્યારે મનુષ્ય એકજ એવો નિષ્કુર છે કે હાથમાં આવે તેનું હડપ કરીને ખુશી થાય છે.

૨૨. જયા સુધી સમય હાથમા છે ત્યા સુધીમાં સાવધ બનો વ્યક્તિ રહે છે પણ સમય કોઈ પણ ઉપાયે ઉભો રહેતો નથી સમયને એજ સુધારી શક્યો છે જે હમેશા સાવધ રહ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલતા કે જીવનમાં સુખી થવુ હોય તો તમારા સંકલ્પોને ઈશ્વર સાથે જોડી દો જો સંકલ્પો ઈશ્વર સાથે નહી જોડો તો ઈશ્વર નારાજ થશે માટે ઈશ્વર ને નારાજન કરો.

૨૩. માણસ જ્યારે પાણીમાં ડુબકી મારે છે ત્યારે તેની પીઠ ઉપર અબજો ગેલન પાણી હોવા છતા તેનો ભાર માણસ ને લાગતો નથી પરંતુ તેને પીપમાં ભરીને માથાઉપર મુકે, તો તેનો ભાર માણસને જણાય છે તેવીજ રીતે મહાત્માઓ આ સંસારમાં રહે છે છતા તેનો ભાર તેને લાગતો નથી જ્યારે સંસારી જીવન મારૂ છે એમ માને છે માટે તેને સંસાર નો ભાર જણાય છે.

૨૪. નદિ પહાડો સાથે અથડાઈને બોલે છે કે કોઈ ખોબો ભરીને પાણી પીઓ તો મારૂ જળ સાર્થક થાય વૃક્ષો બોલે છે કે કોઈ અમારા ફળ ચાખો તો અમારા જન્મની સાર્થકતા માનશું જ્યારે માનવતો જયા ત્યાથી બીજનું મુંડવીને ખાય છે માનવ બીજની સેવા નથી કરી શકતો પણ તે બીજની સેવાથી ખુશી થાય છે.

૨૫. ઈશ્વરે જેનો ફયુઝ કાઢી લીધો તેની જીંદગીમાં પાવર ખલાસ થાય છે આ લોકમાં વીજળીનો ફયુઝ બાંધી આપનાર ઘણા મળશે પણ જીવનનો ફયુઝ તુટશે ત્યારે ઈશ્વર સિવાય તેને કોઈ નહી બાંધી શકે.

૨૬. માનવ મીકુ પકાવી શકે છે પચાવી શકે છે પરંતુ ઈશ્વરે આપેલું મીકુ તેમા આજ સુધી માનવ વધારો કરી શક્યો જ નથી.

૨૭. મહાત્માઓ રૂપ નથી જોતા મહાત્માઓ આત્માને જુવે છે મહાત્મા આકૃતિ નથી જોતા મહાત્માઓ કૃતિને જુવે છે.

૨૮. રઠુગણ રાજા ભરતજી ને કહે છે કે જેવી રીતે તપેલી મા રહેલા ચોખાનો સબંધ સીધો અગ્નિસાથે નથી છતા સમાવાય સબંધ થી ચોખો ચડી જાય છે અગ્નિથી તપેલી તપે છે પાણી તપવાથી ચોખો ચડે છે. તેવીજ રીતે ઈન્દ્રિયોને દુઃખ થવાથી બુદ્ધિને થાય છે બુદ્ધિને દુઃખ થવાથી આત્માને દુઃખ થાય છે ત્યારે ભરતજી કહે છે કે એ તારો ભૂમ છે. એમાં કાંકરા નાખીને જોઈ જો ચડે છે કેનહી આત્માતો સુખ દુઃખ ના સ્વભાવે રહીત છે માટે સુખ દુઃખ એ તો શરીરનો ધર્મ છે આત્માનો નથી.

૨૯. જીવનમાં ભુલ કરવી એ પાપનથી પણ ભુલ કર્યા પછી તેને છુપાવવાની કોશિષ કરવી એ ખતર નાક છે.

૩૦. ભોજન અને ભજન એ બંને સ્વાનુભાવની બાબત છે ભોજન નામની માળા ફેરવ્યાજ કરો ભુખ નહી મટે દુઃખ ભુખ ભગવાનનું સ્વરૂપ એ ત્રણે સ્વાનુભવની બાબત છે તેને આંગળી ચીંધીને નહી બતાવી શકાય.

૩૧. પરમાત્માની પ્રાપ્તિમાં વેદમંત્રોના અધિકારો યોગ્ય જોઈએ મંત્ર અશુદ્ધ બોલાય તો વ્યાથા ઉત્પન્ન કરે છે પરંતુ ભગવાનના નામમાં અશુદ્ધિ આવી જાય તોપણ ચથાવત ફળ મળે છે વાલ્મીકીએ મરા મરા રટણ કર્યું તો પણ રામજી મળ્યા છે.

૩૨. પરમાત્મા અને સંતની પ્રસન્નતામાં પૈસા ગોણ બાબત છે

૩૩. ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભું બોલતા કે ગુરુ થતા પહેલા પોતે પોતાના ગુરૂ થવું પડશે(પડેછે)ગુરૂ થવામાં જવાબદારી રહી છે.

૩૪. દરેક ઈન્દ્રિયોમાં પરમાત્માની સ્થાપના કરીને ક્રિયા કરશો તો તે કર્મ ભક્તિ મય બની જશે માટે દરેક કાર્યમાં પરમાત્માને સ્થાન આપો.

૩૫. વ્યક્તિના જીવનમાં જો કોઈ નબળી કડી હોય તો એજ છે કે પોતે પોતાની જાતને ભુલે છે એજ નબળામાં નબળી કડી છે.

૩૬. પરમાત્મા કહે છે કે મે વ્યક્તિની લાયકાત પ્રમાણે આપ્યું છે છતા સંતોષ ન માને

તો એના જેવો બીજો ભાખારી કોને માનવો.

૩૭. નિયમિતતા સિવાયની દવા જેમ વ્યર્થજાય છે તેમજ નિયમીત વીધી સિવાયના મંત્રો પણ વ્યર્થ જાય છે.

૩૮. વ્યક્તિ સમજે છે જે મારો રૂપિયો સાચો થતો હોયતો બીજાનું ગળુ ભલે થઈ જાય પણ પોતાના સ્વાર્થને ખાતર બીજાનું હીત વીચાર તો નથી એજ મોટો અંધ છે.

૩૯. સિંહ અતિશય કૂર છે છતા પણ પોતાના બચ્ચા ઉપર દયારાખે છે બિલાડી અતિ કૂર છે છતા પોતાના બચ્ચા ઉપર પણ દયા રાખે છે પરંતુ માનવ એકજ એવો કૂર છે જે પોતાની જાત ઉપર પણ દયા રાખતો નથી તો આનાથી વધુ કૂર રાક્ષસ કોણ હોય શકે ?

૪૦. ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલતા કે મને તમે ઈશ્વરન માનો તો કઈ વાધોનથી પરંતુ એટલુતો જરૂર માનજો કે પ્રભુ એ મને પશુ-પક્ષીન બનાવતા મનષ્ય બનાવ્યો તેથી મારા તેને હજારો વંદન હજો.

(વધુ આવતા અંકે)

## ચંદનના વાઘાની સેવાનો દિવ્ય લાભ

સંવત ૨૦૬૨ વૈશાખ સુદ-૩ તા.૩૦-૪-૨૦૦૬ થી જેઠ સુદ-૧૫ તા.૧૧-૬-૨૦૦૬ સુધી ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપશ્રી ગોપીનાથજી મહારાજ તથા શ્રીહરિનું કિશોર સ્વરૂપ એવા શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા દેવોને પાકી સુખડ તથા કેસર ના અતિ સુંદર અને કલાત્મક શણગાર ધરાવવામાં આવે છે આ સેવાનો દિવ્ય લાભ લેવા વિનંતિ.

ચંદન આખા વાઘાના - રૂ.૩૫૦૦/-

ચંદન અડધા વાઘાના - રૂ.૨૧૦૦/-

તથા કુલન નહી તો કુલની પાખડી રૂપે ચથા શક્તિ સેવા કરી શકાય છે

નોંધ :- આ સેવા ચેક/ડ્રાફ્ટ/મનીઓર્ડર તથા રોકડ રમકથી આપી શ્રી ગોપીનાથજી દેવ મંદિરની પાકી પાવતી મેળવી લેવી.

-: લેખક:-

ડૉ.નેત્રપ્રસાદ કૃષ્ણપ્રસાદ દવે હેલ્થ  
કોર્ડોનેટર સમન્વય સંસ્થા-દેવગઢ  
ભારીયા (પંચમહાલ)

# ઈસપગોળ

સંસ્કૃતમાં ઈસપગોળને સ્નિગ્ધજીરક અથવા શ્લક્ષણજીરક કહે છે. હિન્દીમાં તેને ઈસબગોલ કહે છે. મરાઠીમાં પણ ઈસબગોલ કહે છે.

મિસર દેશનું મૂળ વતની ગણાતું ઈસપગોળ અત્યારે ભારતમાં સર્વત્ર થાય છે તેને સારા નિતારવાળી ગોરાડુ બેસર જમીન વધુ માફક આવે છે.

ઈસપગોળના છોડ એક કુટની ઊંચાઈના થાય છે. તેના પાન ચપટાં, લાંબા અને અણીદાર હોય છે. ઈસપગોળના છોડને ઘઉંની જેમ ઊંબીઓ (ડુંડાં) આવે છે. તેનાં બી નાનાં, હોડકા જેવા આકારના અને લાલ-ભૂરા રંગના હોય છે તેના અંતર્ગોળ ભાગમાં સફેદ પાતળુ પડ હોય છે આ બીને પણ ઈસપગોળ કહે છે. તેના ઉપરના સફેદ પડને જુદું કાઢી લેવામાં આવે છે. તે ઈસપગોળની ભૂસી કે સતઈસપગોળ અને ઓળખાય છે. ઔષધિ તરીકે આ ભૂસી જ વપરાય છે બજારમાં ઈસપગોળ અને સતઈસપગોળ બન્ને મળે છે.

ઈસપગોળ કે ઓથમીજીરાને ગુજરાતમાં ઉમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. ઈસપગોળ રંદભેદે કરી ત્રણ જાતનું થાય છે સફેદ લાલ અને કાળું સફેદ જાત ઉત્તમ લાલ જાત મધ્યમ અને કાળી(શ્યામ) જાત કનિવઠ ગુણવાળી ગણાય છે.

પહેલા ગુજરાતમાં ઈસપગોળનો પાક બહુ થતો ન હતો કાનપુર, રેવારી, કોહાર, કરણપુર વગેરે સ્થળે એનું ઉત્પાદન થતું અને અમૃતસરમાં સતઈસપગોળ બનાવાતું પાછળથી પંજાબથી આવેલા વેપારીઓએ સિધ્ધપુર અને ઊંઝાની આજુ બાજુના વિસ્તારોમાં તેના વાવેતરનો ખૂબ પ્રચાર કર્યો એ રીતે ગુજરાતમાં તેનું વાવેતર શરૂ થયું હાલ ઈસપગોળ કે ઓથમીજીરાનું વાવેતર ગુજરાતમાં ખાસ કરીને ઊંઝા અને તેની આજુબાજુના પ્રદેશોમાં સારા પ્રમાણમાં થાય છે.

ભારતમાં દર વર્ષે ચારથી પાંચ લાખ મણ ઈસપગોળનો પાક થાય છે. જેમાંથી દોઢ લાખ મણ સતઈસપગોળ તૈયાર થાય છે તેમાંથી એક લાખ મણ સતઈસપગોળ અમેરિકા અને ઇંગલેન્ડ મોકલવામાં આવે છે બાકીનો માલ ભારતમાં વપરાય છે.

ઔષધિ તરીકે તેનો સર્વપ્રથમ ઉપયોગ અરબસ્તાન અને ઈરાનના પેદોએ કર્યો હતો. કેટલાક વર્ષોથી ભારતમાં પણ તેનો ઔષધિ તરીકે ઉપયોગ થવા માડ્યો છે. હાલમાં સતઈસપગોળ ઔષધિ તરીકે સારા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.

ઈસપગોળના દાણા પાણીમાં નાખવાથી તે ફુલી જઈને લુઆબ(ચીકણો પદાર્થ) બને છે ઈસપગોળ કે સતઈસપગોળ લેવાથી હોજરીમાં પણ તેનો લુઆબ બની જાય છે પછી હોજરી કે આંતરડાના રસો તેના પર કોઈ રાસાયણીક ફેરફાર કરી શકતા નથી. લુઆબ એમ ને એમ બારથી મળમાર્ગે બહાર નીકળી જાય છે જેમ જેમ તે આંતરડાં માંથી પસાર થતો જાય છે તેમ તેમ આંતરડાની દીવાલોમાંની ચાંદીવાળી રસણચાને ચોંટતો જાય છે અને તેને સ્નિગ્ધ બનાવતો જાય છે. આ કારણે આંતરડાંના દરદોમાં જીર્ણ અજીર્ણમાં અને આંતરડાની રસત્વચાના વરમ કે ચાંદામાં ઈસપગોળ સમાન સ્નિગ્ધ અને શામક અસર કરનારી બીજી એકેય ઔષધિ નથી. આંતરડાંના

વરમ અને ચાંદાં રૂઝાવનારી ઔષધિ તરીકે તે અકસીર અને ઉત્તમ સાબિત થયેલ છે. વળી, આંતરડામાં રહેલ આમદોષ અને કાચા પદાર્થોને તે પોતાની સાથે નીચે લઈ આવે છે. આથી જૂની કબજિયાતને નાબૂદ કરે છે. કબજિયાતમાં પેરેફીન લિક્વિડ લેવા કરતાં ઈસપગોળનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે, કારણ કે તેનાથી નુકશાન થવાની સંભાવના બહુ ઓછી હોય છે.

ઈસપગોળ સામાન્ય જંતુજન્ય મરડા પર અકસીર છે. અમીબા નામના જંતુથી ઉત્પન્ન થતા મરડા પર ઈન્દ્રજવ કે કડાછાલ સાથે લેવાથી તે સારો ફાયદો આપે છે ઝાડા અને મરડાનાં દરદોમાં તે આશીર્વાદ સમાન ઔષધિ છે.

મરડો, કબજિયાત, આંતરડાંની ગરમી, આંતરડાંના ચાંદા તથા વાઈના રોગોમાં સતઈસપગોળનો ખાસ ઉપયોગ થાય છે ગરમીના રોગોમાં તો સતઈસપગોળ અકસીર ઔષધિ ગણાય છે.

ઈસપગોળની ભૂસી અર્થાત સતપઈસપગોળ દુધમાં મેળવી સાકર નાખીને સેવાય છે અથવા તોલા ગમર પાણીમાં ઈસપગોળના દાણા કે ભૂસી નાખી, પાંચેક મિનિટ મૂકી રાખી, સાકર મેળવી અર્ધા ચમચાથી એક ચમચા સુધી દિવસમાં બેવાર સેવાય છે. બાંબા સમયનાં દરદોમાં એક તોલા સુધી એકી વખતે લઈ શકાય છે.

ઈસપગોળ મધુર, પિચ્છિલ, શીતવીર્ય, સ્નિગ્ધ, ઈષત્સંગ્રાહી, કિંચિત્, વાતકારક, કફપિત્તહર, મૂત્રલ, ઉપલેપક, તૃષ્ણાહર, જવરસંતાપહર છે. એ રક્તાતિસાર, અત્યાર્તવ, શુક્રમેહ, ગ્રુર્ણ મળાવરોધ, ઊલટી, તૃષ્ણારોગ, મુમદાહ અને સુકી ખાંસીને દુર કરે છે. પેશાબની ગરમી, ગુરદાના વરમ અને પ્રમેહમાં પણ તેના સ્નિગ્ધ અને શામક દુણોને લીધે સારો ફાયદો કરે છે. મરડા અને સંગ્રહણીના રોગમાં તે ખૂબજ ફાયદા કારક છે તેનાં બી શીતળ અને સ્નિગ્ધતા આપનાર છે. ઈસપગોળ મૂલ છે.

ઈસપગોળની ચાર માસા ભૂસી સાકર સાથે મેળવા ફાકી જઈને ઉપર દુધ પીવાથી ધાતુપુષ્ટિ થાય છે એકાદ માસ સુધી એ રીતે સેવાથી સત્વપ્રદોષ, ધાતુનું પાતવાપણું, બહુમુમતા અને ધાતુની નબળાઈ દુર થાય છે. ઈસપગોળની દુધમાં ખીર કરીને પીવાથી સ્વપ્રદોષમાં ફાયદો થાય છે.

ઈસપગોળ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળીને પીવાથી તૃષ્ણારોગ શાંત થાય છે.

એક માસ સુધી હંમેશા ઈસપગોળ ફાકતા રહેવાથી શ્વાસરોગમાં સારો ફાયદો થાય છે. ચાર પાંચ માસમાં શ્વાસરોગ તદ્દન મટી જાય છે. બે વર્ષ સુધી સેવન કરવાથી વીસ વર્ષનો જુનો દમરોગ મટે છે.

ઈસપગોળ બે થી ચાર તોલા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેમાં બે તોલા ખડીસાકર નાખીને પીવાથી જવરાતિસાર, રક્તાતિસાર, ગ્રુર્ણતિસાર, રક્તાર્શ, જવર, પ્રમેહ, અને દાહ વગેરે રોગો મટે છે.

ઈસપગોળ એક તોલો અને સાકર એક તોલો મેળવી તેના ત્રણ ચાર ભાગ કરી દિવસ દરમિયાન ત્રણ ચાર વાર ચાવીને ખાવાથી મરડો મટી જાય છે.

## ● સત્સંગ સમાચાર ●

દાદાબાયરના પવિત્ર દરબારગઢમાં શ્રી ગોપીનાથજીમહારાજની પૂર્ણકૃપાથી તથા ગઢપુર મંદિર ટ્રસ્ટી બોર્ડના સાથ સહકારથી શ્રી નોતમભાઈ હળવદીયાના પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કથાના વક્તાપદે ગઢપુર મંદિરના કો.શા.સ્વા.ઘનશ્યામવલ્લભદાસજીએ બિરાજી શ્રીમદ્ સત્સંગીજીવનની સુંદર કથાનું રસપાન કરાવ્યું હતું. જેમણે ૪૦ વર્ષ પર્યન્ત ગઢપુર મંદિરના મુખ્ય મેતાજી તરીકે સેવા બજાવી એવા અ.નિ. શ્રી નોતમભાઈ નાનાલાલ હળવદીયાના શુભ સંકલ્પથી તેમના સુપુત્રો શ્રી ચેતનકુમાર તથા શ્રી ચિરાગકુમાર તથા ભાઈશ્રી રસીકભાઈ આદિ પરિવાર દ્વારા કથામાં આવતા શ્રી ઘનશ્યામજન્મોત્સવને ખુબજ ધામ ધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંહિતાપાઠનું વાંચન શા.કે.પી.સ્વામી એ કર્યું હતું. આ પ્રસંગે ગઢપુર મંદિરના સંતો એ તથા શ્રી એસ.પી.સ્વામી એ નોતમભાઈ મંદિરનું એક અભિન્નઅંગ હતા. સ્વેત કપડામાં સંત હતા. તેમના પરિવાર ને શ્રી ગોપીનાથજી મહારાજ સુખી રાખે એવા આશિષ આપ્યા હતા.સભાનું સંચાલન સ્વા.છપૈયાપ્રકાશદાસજી એ કર્યું હતું.

### દેદરડામાં ૧૧માં વાર્ષિક પાટોત્સવે સપ્તાહ

ગઢપુર તાબાના દેદરડા ગામે મંદિરના ૧૧માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન સત્સંગસમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના વક્તા પદે ગઢપુરના નવયુવાન શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજી એ બિરાજી કથાનું રસપાન કરાવ્યું હતું. કથાની સમાપ્તિમાં વડતાલથી ભાવિઆચાર્ય લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ પધારી સત્સંગ સમાજને સુંદર આશિર્વાદ પાઠવ્યા હતા. કથા દરમ્યાન સભાનું સંચાલન શ્રી ઘનશ્યામસ્વામી એ કર્યું હતું.

ગઢપુર તાબાના વલ્લભીપુર ગામે મંદિરના ૯૬ માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પંચદિનાત્મક કથાનું આયોજન સત્સંગસમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેના વક્તાપદે ગઢપુર મંદિરના કો.શા.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી તથા શા.સ્વા.શાંતિપ્રિયદાસજી ડભાણવાળાએ બિરાજી કથામૃતનું પાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ થી પ.પૂ.૧૦૮ ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. અને સત્સંગ સમાજને રૂડા આશીર્વાદ આપ્યા હતા.

ગઢપુર તાબાના મહુવા તાલુકાના તાવેડા ખાતે નૂતન નવ્ય ભવ્ય કલાત્મક મંદિર માં બિરાજેલ શ્રી ગોપીનાથજીમહારાજ આદિદેવોની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પ.પૂ.૧૦૮ લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજના હસ્તે તા.૪-૫-૦૬ના રોજ વેદોક્તવિધિ પ્રમાણે કરવામાં આવી હતી. પછી શ્રી એસ.પી.સ્વામી આદિ સંતોના પ્રવચન બાદ પ.પુ.લાલજી મહારાજે સુંદર આશિર્વાદની અમૃત વર્ષા કરી હતી.

ગઢપુર તાબાના રાજુલા તાલુકાના કુંભારીયા ખાતે નવ નિર્માણ પામેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દેવોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પ.પૂ.૧૦૮ લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે તા.૩-૫-૦૬ના રોજ કરવામાં આવી હતી. મહોત્સવ અંતર્ગત કથા અને સત્સંગ સભા યોજાઈ હતી. જેમા શ્રી એસ.પી.સ્વામી તથા સંતોએ પ્રવચન કર્યા બાદ પુ.લાલજી મહારાજે આશિર્વાદ આપ્યા હતા.

ગઢપુર તાબાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે તા.૪-૫-૦૬ના રોજ પ.પુ. ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે પધારી વેદોક્તવિધિ સર પ્રતિષ્ઠાવિધિ કરી આરતિ ઉતારી હરિભક્ત સમુદાયને આશિર્વાદ આપ્યા હતા.

ગઢપુર તાબાના ગારીયાધાર તાલુકાના પીપરડી(ઘોબા) ખાતે પ.પૂ.લાલજી મહારાજશ્રીએ પધારી તા.૫-૫-૦૬ના રોજ દેવોની પ્રતિષ્ઠા વિધિ કરી આરતિ ઉતારી હતી. ત્યાર પછી સભામાં સંતો-ભક્તો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન બાદ પ.પુ.લાલજી મહારાજશ્રીએ ભક્તો ને આશીર્વાદ પાઠવ્યા હતા.

ગઢપુર તાબાના સાવરકુંડલા તાલુકાના ફિફાદ ખાતે પ.પૂ.ભાવિ આચાર્ય લાલજીશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે દેવોની પ્રતિષ્ઠા વિધિ અને આરતિ ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ સંતો અને પ.પૂ.શ્રી લાલજીમહારાજે આશિર્વાદની અમૃત વર્ષા કરી હતી.

ગઢપુર પતિશ્રી ગોપીનાથજીમહારાજના તાબા કોટડા(પીઠા) ખાતે ગઢપુર ટ્રસ્ટી બોર્ડના સાથ સહકારથી નૂતન મંદિરનો શિલાન્યાસ વિધિ તા.૫-૫-૦૬ના રોજ રાખવામાં આવી હતી. આ પ્રસંગે ગઢપુર થી શ્રી એસ.પી.સ્વામી. તથા નિત્યસ્વરૂપ સ્વામી તથા ચેરમેનશ્રી હરજીભાઈ ભીમાણી તથા કો.ધર્મપ્રસાદ દાસજી આદિ એ ખાતવિધિ કર્યો હતો.

### ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ

ગઢપુર તાબાના સાવરકુંડલા તાલુકાના બાટડા ખાતે પ.પૂ.લાલજી મહારાજશ્રી ના આશિર્વાદથી સમસ્ત સત્સંગસમાજના સાથ સહકાર અને ગઢપુર પુ.સ્વા. નરનારાયણદાસજી ની પ્રેરણાથી સુંદર નવ્ય ભવ્ય ભાઈઓ અને બહેનોનું નૂતન મંદિર પ્લોટ વિસ્તારમાં તૈયાર થયું તેનો પ્રતિષ્ઠા વિધિ કરવા પ.પુ.લાલજી મહારાજ તા.૧૦-૫-૦૬ના રોજ બપોરે પધાર્યા હતા. અને ભવ્ય શોભાયાત્રા ગામના ભાગોળેથી હજારો ભક્તો સાથે નિકળી હતી. રાત્રે કાર્યક્રમ માં પણ પ.પૂ.લાલજીમહારાજ પધાર્યા હતાં સવારે ૮-૦૦ કલાકે ભાઈઓ ના મંદિરમાં અને બહેનોના મંદિરમાં ઊરાજતા દેવોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કરી હતી મહોત્સવ અંતર્ગત શ્રી સત્સંગી જીવન ની સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વક્તા પદે ગઢપુર મંદિર ના કો.શા.સ્વા.ઘનશ્યામવલ્લભદાસજી એ ઊરાજી સંગીત સાથે સુમધુર કથાનું રસપાન કરાવ્યું હતું. આ. પ્રસંગે ગઢપુર શ્રી ગોપીનાથજી દેવ મંદિર ના ચેરમેનશ્રી પાર્ષદ ભાણજી ભગત તથા બોર્ડ સલાહકારશ્રી એસ.પી.સ્વામી તથા ટ્રસ્ટીશ્રી શા.કો.બ્ર.સ્વા.જ્ઞાનપ્રકાશાનંદજી તથા શ્રી હરજીભાઈ ભીમાણી તથા ગોરધનભાઈ કાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધામે ધામથી અનેક સંતો પણ પધાર્યા હતા. પ.પૂ.લાલજી મહારાજે સભામાં પધારી બાટડા તો મારૂ છે એમ કહી સત્સંગ વિશેષ વૃદ્ધિ પામે એવા સુંદર આશિર્વાદ આપ્યા હતા. પછી શ્રીહરિયાગ માં શ્રીફળ બીડુ હોમવા પૂ.લાલજી મહારાજશ્રીએ પધારી ચજ્ઞાની પૂર્ણાહુતિ કરી હતી.

ગઢપુર તાબાના ઘોળા પાસેના લંગાળા ખાતે તા.૨૧-૫-૦૬ થી ૨૭-૫-૦૬ સુધી શ્રીમદ્ ભાગવત સમાહ પારાયણનું આયોજન સત્સંગસમાજને મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગઢપુરના શા.સ્વા.કૃષ્ણપ્રકાશદાસજી(કે.પી.સ્વામી)એ પોતાના જીવનની પ્રથમ કથા વક્તાપદે ઊરાજી વાંચી ભક્તોને રાજીકર્યા હતા.

# શ્રી ગોપીનાથજી દેવ સહિતની ચૌદ મૂર્તિઓને થયેલ આખા થાળનું લીસ્ટ માહે એપ્રિલ - ૨૦૦૬

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧	૧-૪-૦૬	લીખાળા	વલ્લભભાઈ ખીમજીભાઈ	કાજુ મૈસુબ
૨	"	આફીકા	સમીર ભુપતભાઈ	મગજ
૩	"	એકલારૂ	અ.નિ.વાલજીભાઈ કે.	મૈસુબ
૪	"	બોટાદ	કરશનભાઈ કે.	મૈસુબ
૫	"	બોટાદ	લખમણભાઈ જવેરભાઈ	મૈસુબ
૬	૨-૪-૦૬	મીરાંરોડ	હરિભગત	મગજપુરી
૭	"	અમદાવાદ	પ્રવિણભાઈ વી.	મગજપુરી
૮	"	સાતપડા	પોપટભાઈ ડી.	મોહન થાળ
૯	"	અમદાવાદ	પ્રવિણભાઈ વી.	મગજ
૧૦	"	સાતપડા	પોપટભાઈ ડી.	મોહનથાળ
૧૧	"	અમદાવાદ	નિર્મળભાઈ સી.	મગજપુરી
૧૨	૩-૪-૦૬	ભાવનગર	રમેશભાઈ ડી.	મગજપુરી
૧૩	"	અમદાવાદ	અનંતરાય એન.	મૈસુબ
૧૪	"	ગઢડા	શ્રી સ્વા. વિદ્યા મંદિર	મગજપુરી
૧૫	"	ભાવનગર	હંસાબેન ભાવનસાર	મગજપુરી
૧૬	૪-૪-૦૬	ગઢડા	શ્રી સ્વા. વિદ્યા મંદિર	મગજપુરી
૧૭	"	નાગલપર	દેવભાઈ	મગજપુરી
૧૮	૫-૪-૦૬	અમદાવાદ	શાંતાબેન	મૈસુબ
૧૯	"	ગઢડા	શ્રી સ્વા.વિદ્યા મંદિર	મગજપુરી
૨૦	"	રળીયાણા	વલ્લભભાઈ હરખાભાઈ	મગજપુરી
૨૧	"	અણીડા	નારણભાઈ ડી.	મોતૈયાલાડું
૨૨	"	જામનગર	નિર્મળાબેન	મોહનથાળ
૨૩	"	પરવાળા	બાબુભાઈ ઓઘાભાઈ	મોતૈયાલાડું
૨૪	"	કાલસરી	હરિલાલ માધવભાઈ	મગજપુરી
૨૫	"	અમદાવાદ	રાહુલ	મગજપુરી
૨૬	"	કોટડી	હંસાબેન	શીખંડપુરી
૨૭	"	અમદાવાદ	જવેરભાઈ બી.	મૈસુબ
૨૮	૬-૪-૦૬	ગઢડા	શ્રી સ્વા.વિદ્યા મંદિર	મૈસુબ
૨૯	"	ગઢડા	શ્રી સ્વા.વિદ્યા મંદિર	શીખંડ પુરી
૩૦	"	સુરજપુર	દેવરાજભાઈ	મોતૈયા લાંડુનોથાળ
૩૧	"	ભુપગઢ	કરશનભાઈ માધાભાઈ	મગજપુરી
૩૨	"	હનુમાનપરા	અ.નિ.ઉમેદભાઈ	મોતૈયાલાડું
૩૩	૭-૪-૦૬	ગુંદાળા	દયાળભાઈ બી.	મોતૈયાલાડું

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૩૪	૭-૪-૦૬	વડોદરા	દં.સ્વ. દક્ષાબેન વી.	મગજપુરી
૩૫	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન.હળવદીયા	મગજપુરી
૩૬	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન.હળવદીયા	પુરણ પોળી
૩૭	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન.હળવદીયા	શીખંડ પુરી
૩૮	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન.હળવદીયા	મગજ પુરી
૩૯	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન.હળવદીયા	મોહનથાળ
૪૦	"	ગઢડા	અ.નિ.નૌતમલાલ એન. હળવદીયા	શીખંડપુરી
૪૧	"	અમદાવાદ	ધીરુભાઈ મોહનભાઈ	મગજ પુરી
૪૨	"	રાજકોટ	કોરાટ બાબુભાઈ આર.	મેશુબ
૪૩	"	સા.કુંડલા	હરેશભાઈ દેશાઈ	મગજ પુરી
૪૪	"	યુ.એસ.એ.	પ્રવિણાબેન વી.	મગજ પુરી
૪૫	"	મોબાસા	બિંદુબેન કુંવરજીભાઈ	મગજ પુરી
૪૬	"	રળીયાણા	અરવિંદભાઈ જી.	મગજ પુરી
૪૭	"	પીપરલા	પંડ્યા નાનજીભાઈ એન.	મોતૈયાલાડું
૪૮	"	એકેવાળીયા	મનસુખભાઈ કે.	મગજપુરી
૪૯	"	વેળાવદર	દિવાળીબેનવ	સાંજનાદુધપુરી
૫૦	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જોબનપુત્રા	ધારીપુરી
૫૧	"	અભરામપરા	ધીરુભાઈ મોહનભાઈ	કાજુમેશુબ
૫૨	૮-૪-૦૬	વેળાવદર	કાળુભાઈ જીવાભાઈ	મગજપુરી
૫૩	"	ગઢડા	સ્વા વિદ્યા મંદિર	મોહનથાળ
૫૪	"	વંડા	ગોરઘનભાઈ જીવરાજભાઈ	મેશુબ
૫૫	"	અમૃતવેલ	જાદવભાઈ લવજીભાઈ	મગજ પુરી
૫૬	"	અમરેલી	નિતીનભાઈ વરીયા	મગજપુરી
૫૭	૯-૪-૦૬	રાજકોટ	શ્રી મથુરભાઈ દતાણી	મગજપુરી
૫૮	"	શોડુભાર	રામજીભાઈ પોપટભાઈ	મગજપુરી
૫૯	"	કચ્છ	ભુમિપુત્ર	સુખડી
૬૦	"	આટકોટ	નરેશભાઈ એમ.	મગજપુરી
૬૧	૧૦-૪-૦૬	અકાળા	જગદીશ સવજીભાઈ	મોતૈયાલાડું
૬૨	"	મુંબઈ	દોશી ભૂપતરાય પ્રેમચંદ	મોહનથાળ
૬૩	"	લાઠીદડ	શ્રી હરિષ્કૃષ્ણ મહારાજ ચાત્રાસંઘ	ચુરમા લાડું
૬૪	"	સુરજપર	મીઠાભાઈ પી.	મગજપુરી
૬૫	"	ગઢડા	વાઘેલા કાંતાબેન	મોતૈયાલાડું
૬૬	"	ભડીયાદ	રઘુભાઈ રામભાઈ	સાટા
૬૭	"	વડોદરા	તપનભાઈ પ્રદીપભાઈ	મેશુબ
૬૮	૧૧-૪-૦૬	પીઠવડી	ગોવિંદભાઈ જીવાભાઈ	મગજપુરી
૬૯	"	વડોદરા	પ્રવિણકુમાર એન.	મોહનથાળ

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૭૦	૧૧-૪-૦૬	વેળાવદર	પ્રવીણકુમાર એન.	મોહનથાળ
૭૧	"	વલસાડ	માનેભાઈ કાનજીભાઈ	મોતૈયાલાડુ
૭૨	"	ગઢાળી	ડૉ.કુળદીપસીંહજી જી.	કાજુમૈશુબ
૭૩	"	ભુપગઢ	પ્રેમજીભાઈ પી.	મગજ
૭૪	"	શાંતીનગર	મગનભાઈ	મોતૈયાલાડુ
૭૫	"	નાના સાવર	પ્રાગજીભાઈ વી.	મગજપુરી
૭૬	"	મુંબઈ	અતુલભાઈ હરીભાઈ	કેરીપુરી
૭૭	"	અમરેલી	પંકજભાઈ	મગજપુરી
૭૮	"	લાઠીદડ	અ.નિ.વીઠલભાઈ વી.	મૈશુબ
૭૯	"	સાતપડા	હિંમતભાઈ ડી.	કાજુમેસુબ
૮૦	"	મેમકા	જનકબેન	મગજપુરી
૮૧	"	અકાળા	મનુભાઈ	મૈશુબ
૮૨	૧૩-૪-૦૬	અકાળા	ગોબર આર.	મોતૈયાલાડુ
૮૩	"	નિંગાળા	વેલજીભાઈ આર.	કાજુ મૈશુબ
૮૪	"	વડોદરા	ચોકસી હરિકૃષ્ણ	મોહનથાળ
૮૫	"	વંડા	સ્વ મંજુલાબેન	મગજપુરી
૮૬	"	જોટીંગડા	ગોવિંદભાઈ ગોવાલ	મોહનથાળ
૮૭	"	ગુંદાળા	સતસંગ મંડળ	મગજપુરી
૮૮	"	દુધાળા	ભગવાનભાઈ પી	મગજપુરી
૮૯	"	કેરાળા	ગોરધનભાઈ	મોહનથાળ
૯૦	"	માંડવધાર	પોપટાભાઈ લલુભાઈ	મગજપુરી
૯૧	"	ગોંડલ	શા.સ્વા.નારાયણસ્વરૂપદાસજી	મગજપુરી
૯૨	"	ભાવનગર	ચેતનભાઈ	કાજુમૈશુબ
૯૩	"	વેળાવદર	કનુભાઈ બાબુભાઈ	મોહનથાળ
૯૪	"	વેળાવદર	દેવજીભાઈ પરશોત્તમભાઈ	મગજપુરી
૯૫	"	સાતપડા	રસીકભાઈ શંભુભાઈ	મગજપુરી
૯૬	"	રાજકોટ	પ્રશાંતકુમાર ઘનશ્યામભાઈ	કેરીપુરી
૯૭	"	ભુપગઢ	જગદીશભાઈ જીવાભાઈ	મગજપુરી
૯૮	૧૪-૪-૦૬	કંડારી	પા.આનંદલાલ સી.	મગજપુરી
૯૯	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જોબનપુત્રા	કાજુમૈશુબ
૧૦૦	"	મુંબઈ	વિરેન્દ્રકુમાર	મગજપુરી
૧૦૧	"	યુ.એસ.એ.	સોનલબેન	બદામ મૈશુબ
૧૦૨	"	બોમ્બે	દક્ષેશકુમાર એમ.	મોહનથાળ
૧૦૩	"	કંડારી	આનંદલાલ સી.	મગજપુરી
૧૦૪	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જે. જોબનપુત્રા	કાજુમૈશુબ
૧૦૫	"	રાજકોટ	ઘનશ્યામભાઈ જે.જોબનપુત્રા	મોહનથાળ

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧૦૬	"	રાજકોટ	પ્રશાંતકુમાર ઘનશ્યામભાઈ	મગજપુરી
૧૦૭	"	મુંબઈ	વિરેન્દ્રકુમાર	મગજ
૧૦૮	"	બોટાદ	નટુભાઈ જે. બોધી	મગજ
૧૦૯	"	યુ.એસ.એ.	સોનલબેન	બદામ મેસુબ
૧૧૦	"	વંડા	રામજીભાઈ એન.	મગજ
૧૧૧	"	મુંબઈ	હરિભગત	મોતૈયા
૧૧૨	૧૫-૪-૦૬	મુંબઈ	ગીરીસભાઈ જયતીભાઈ	મોતૈયા
૧૧૩	"	સારસા	કિન્નરીબેન	મૈશુબ
૧૧૪	"	સારસા	કિન્નરીબેન	મોહનથાળ
૧૧૫	"	વડોદરા	દિવ્યાસકુમાર આર.	મૈશુબ
૧૧૬	"	આણંદ	રોકડીયા હનુમાનજી	મૈશુબ
૧૧૭	"	મુંબઈ	બા શાતાનંદજી	મગજ
૧૧૮	૧૬-૪-૦૬	બોરીવલી	મંજરીકબેન એસ.	મોહનથાળ
૧૧૯	"	વડોદરા	ઈશ્વરભાઈ પ્રાગજીભાઈ	મૈશુબ
૧૨૦	"	અમરેલી	સોની વળવંતરાય આર.	મગજ
૧૨૧	૧૭-૪-૦૬	કોકડા	ગોટાભાઈ	મગજ
૧૨૨	"	ઓળીયા	કનુભાઈ વી.	કાજુ
૧૨૩	"	વડોદરા	સુધાકરભાઈ	મોહનથાળ
૧૨૪	૧૮-૪-૦૬	કોરીયા	સુરેશભાઈ ચાવડા	મગજ
૧૨૫	"	વડોદરા	શ્રી ડી.એન.કાનાણી	બદામ
૧૨૬	"	વડોદરા	શ્રી ડી.એન. કાનાણી	દુધપુરી
૧૨૭	"	આંબરડી	અ.નિ.ગોરધનભાઈ જીવાભાઈ	મગજ
૧૨૮	"	રળીયાણા	અ.નિ.છાગનભાઈ ત્રીકમભાઈ	બદામ મેસુબ
૧૨૯	૧૭-૪-૦૬	ટાટમ	સ્વામિનારાયણ ગુરુકુળ ટાટામ	મગજ
૧૩૦	"	લાઠી	ગીરીશભાઈ આર.	મગજ
૧૩૧	"	વેલાવદર	શાંતીભાઈ એમ.	કાજુમૈશુબ
૧૩૨	"	આંબરડી	ઘનશ્યામભાઈ મધુભાઈ	મગજ
૧૩૩	"	ગઢડા	શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજી	મગજ
૧૩૪	"	વીકળીયા	ગોપીનાથજી મહારાજ	મગજ
૧૩૫	૨૧-૪-૦૬	અડતાળા	ગણેશભાઈ ગોવિંદભાઈ	મગજ
૧૩૬	"	આંબરડી	અશોકભાઈ બી.	મગજ
૧૩૭	"	જમરાળા	રામજીભાઈ ડી.	મોતૈયા
૧૩૮	"	ભાવનગર	એચ. એલ.ઓઝા	મોહનથાળ
૧૩૯	"	ખાલપર	ચંદુલાલ લવજીભાઈ	મગજ પુરી
૧૪૦	"	મલાડ	મહેન્દ્રભાઈ વાડીલાલ	મગજ
૧૪૧	"	સુરેન્દ્રનગર	સોની ત્રીકમભાઈ એસ.	બદામ મૈશુબ

અ.નં	તારીખ	ગામ	નામ	થાળ
૧૪૨	૨૨-૪-૦૬	કણોદ	ત્રિભોવનવ શકરાભાઈ	મગજપુરી
૧૪૩	"	પુના	અ.નિ.ડાયાભાઈ મકવાણા	મૈશુભ
૧૪૪	"	યુ.એસ.એ.	સંગીતાબેન	સુખડી
૧૪૫	૨૩-૪-૦૬	ડભાણ	પૂ.સ્વા.માધવપ્રસાદદાસજી	જાદરીયા
૧૪૬	"	અમદાવાદ	તુષારભાઈ પી.	મગજ
૧૪૭	"	અમદાવાદ	હેમત બી. શેલત	સાંજનાદુધપુરી
૧૪૮	"	કજાપુર	કનુભાઈ એન.	મોતૈયાલાડુ
૧૪૯	"	અમદાવાદ	મહેશકુમાર	મોહનથાળ
૧૫૦	"	વડોદરા	જયમીનકુમાર	મોહનથાળ
૧૫૧	"	પીઠવડી	પા.ચતુરભાઈ પી.	મૈશુભ
૧૫૨	"	દામનગર	બાબુભાઈ	મગજપુરી
૧૫૩	"	ઠમિ	હરિભગત	મૈશુભ
૧૫૪	૨૪-૪-૦૬	અકાળા	ભરતભાઈ બી.	મગજપુરી
૧૫૫	"	દાંતરડી	માધાભાઈ જાદવભાઈ	કાજુમૈશુભ
૧૫૬	"	નિંગાળા	કિશોરભાઈ વી.	મૈશુભ
૧૫૭	૨૫-૪-૦૬	વડોદરા	હસમુખભાઈ એચ.	મૈશુભ
૧૫૮	"	રાજકોટ	અ.નિ.દયાબેન આર.	મૈશુભ
૧૫૯	૨૬-૪-૦૬	લાઠી	કાળુભાઈ ઈંદુભાઈ	મૈશુભ
૧૬૦	"	નાનામાશીયાળા	જીતુભાઈ એસ. માલવીયા	મગજપુરી
૧૬૧	૨૭-૪-૦૬	સલડી	ભુપતભાઈ આર.	મગજપુરી
૧૬૨	"	પીપરલા	બારીયા ઘનશ્યામભાઈ	મોતૈયાલાડુ
૧૬૩	"	અમદાવાદ	બાબુભગત	મગજપુરી
૧૬૪	૨૮-૪-૦૬	અમદાવાદ	સમીર સીનેથીટીક	મૈશુભ
૧૬૫	"	અમદાવાદ	અ.નિ.માવજીભાઈ રૂડાભાઈ	મૈશુભ
૧૬૬	"	માનગઢ	વિરજીભાઈ પી.	મોતૈયાલાડુ
૧૬૭	"	પીઠવડી	શ્રી ધુવિનકુમાર ડી.	શીખડ પુરી
૧૬૮	"	સુરત	કવિત દેવાગ	મૈશુભ
૧૬૯	૨૩-૩-૦૬	વંડા	અ.નિ. મનજીભાઈ વેકરીયા	મગજપુરી
૧૭૦	"	ડુંગરપુર	પંકજભાઈ દુલાભાઈ	મોતૈયાલાડુ
૧૭૧	"	ભંડારીયા	ઘનશ્યામભાઈ	મોહનથાળ
૧૭૨	"	વીરસદ	ઘનશ્યામભાઈ એમ.	મગજપુરી
૧૭૩	"	રાજકોટ	વજલાલ એમ.	મોહનથાળ
૧૭૪	"	યુ.એસ.એ.	પ્રિતેશકુમાર	મૈશુભ

અનુસધાન પાના નં. ૨૭નું શરૂ

અ. નં.	તારીખ	મહિના અને તીથી	ગામ	નામ	રસોઈની વિગત
૪૧	૨૯-૪-૦૬	" ૨	બોટાદ	હરજીભાઈ નારણભાઈ કળથીયા ગસ્તે બટુકભાઈ નારણભાઈ કળથીયા	મોહનથાળ, મોતેયાલાડું ભજુયા
૪૨	૨૯-૪-૦૬	" ૨	અમદાવાદ	ધીરજભાઈ કાકડીયા	રસોઈ સીધા નિમિતે
૪૩	૨૯-૪-૦૬	" ૨	અકાળા	દેલાભાઈ નરશીભાઈ સખોલીયા	રસોઈ સીધા નિમિતે
૪૪	૩૦-૪-૦૬	" ૩	અમદાવાદ	અ. ની. કાન્તીલાલ કોઠારી તથા અ. નિ. વસંતબેન કોઠારી હસ્તે ભરતભાઈ તથા સહપરિવાર	મોહનથાળ, બુંદી, મરચાના ભજુયા
૪૫	૩૦-૪-૦૬	" ૩	ભાવનગર	અ. નિ. મણીલાલ રૂપચંદભાઈ ગોળવાળા	રસોઈ સીધા નિમિતે
૪૬	૩૦-૪-૦૬	" ૩	ભાવનગર	ધીરુભાઈ મોહનભાઈ કાછડીયા	રસોઈ સીધા નિમિતે

(અનુસધાન પાના નં. ૧૮નું શરૂ)

ઈસપગોળની ભૂસી અને ખડી સાકર ખાવાથી બાળકોની રક્ત સંગ્રહણી મટે છે.

ઈસપગોળને ગાયનું ઘી લગાડી, શીકે, ખાંડ સથે મેળવીને આપવાથી બાળકોનો જીર્ણ અતિસાર મટે છે.

ઈસપગોળ અથવા તેની ભૂસી અર્ધો તોલો અને અર્ધો તોલો ખાંડ મેળવી દરરોજ રાત્રે દુધ સાથે પીવાથી એક બે માસમાં આંતરડામાં ચોટી રહેલો મળ દુર થાય છે આંતરડાનું કાર્ય નિયમિત બને છે અને જીર્ણ મળાવરોધ કબજિયાત દુર થાય છે

ઈસપગોળ અર્ધો તોલો રાત્રે પાણામાં પલાળી રાખી સવારે મસળી, ગાળી તેમાં બદામનું તેલ અને સાકર નાખીને લેવાથી રેચ લાદે છે અને કોઠાની શુદ્ધિ થાય છે.

ઈસપગોળનો ફાંટ કે હિમ ખાંડ મેળવીને પીવાથી રક્તપ્રદર, અત્યાનેવ, રક્તમેહ, રક્તાતિસાર વગેરે રોગોમાં થતો રક્તસ્માવ બંધ થાય છે આ ફોટ પ્રદર રોગોમાં પણ ફાયદાકારક છે.

ઈસપગોળનો ઉકાળો લેવાથી જવનાતિસાર મટી જાય છે.

ઈસપગોળ થોડી માત્રામાં સાકર સાથે સેવાથી બસ્તી તથા મૂમમાર્ગના રોગોમાં ફાયદો થાય છે.

ઈસપગોળના ચૂર્ણને પાણી તથા તેલમાં મેળવી, પોટીસ બનાવી વ્રણ(ધા) પર બાંધવાથી પડ ખેંચાઈ આવે છે, વેદના શાંત થાય છે અને વ્રણ શુદ્ધ થઈને જલદી રૂજાય છે.

ઈસપગોળને ગુલાબજળમાં ભીંજવી, લુઆબ કરી માથા પર લેપ કરવાથી તાપ, ગરમી કે પિત્તપ્રકોપજન્ય મસ્તક પીડા મટી જાય છે.

ઈસપગોળ વાટી, તેની પોટલી કરી, માથે મૂકવાથી માથાની પીડા મટે છે.

ઈસપગોળને ખાંડ, પાણીમાં ઘૂંટી, લેપ કરતા રહેવાથી બાળકોની વૃષણવૃદ્ધિ થોડાજ દિવસોમાં મટી જાય છે.

**માહે એપ્રિલ-૨૦૦૬ માં શ્રી ગોપીનાથજી મહારાજનો યાળ તથા ત્યાગી-સંતો બ્રહ્મચારી અને પાર્ષદોને આપવામાં આવેલ રસોઇના દાતાઓની યાદી**

અ. નં.	તારીખ	મહિના અને તીથી	ગામ	નામ	રસોઈની વિગત
૧	૧-૪-૦૬	ચૈત્ર સુદ -૩/૪	તોતણીયાળા	પ્રકુલભાઈ ખામજીભાઈ કાકડીયા	મોહનયાળ, સેવ
૨	૨-૪-૦૬	" ૫	ભેસાણ હા. સુરત	મુકેશભાઈ વિરજીભાઈ તથા અમીતભાઈ વિરજીભાઈ અ.નિ. વિરજીભાઈ વેકરીયાની પુર્ણસ્મૃતિમાં	મોહનયાળ, મોતેયાલાડું, મેથીનાભજીયા
૩	૩-૪-૦૬	" ૬	અમદાવાદ	અ.નિ. શાં. ચો રતનબાની સ્મૃતિમાં હસ્તે શાં. ચો. સુંદરબા	મોતેયા લાડું, ગાંઠીયા
૪	૫-૪-૦૬	" ૮	વડોદરા	નગીનભાઈ આપાભાઈ પટેલ	રસોઈ સીધા નિમિતે
૫	૭-૪-૦૬	" ૯	ગઢડા	ગં. સ્વ. રસીલાબેન નૌરામલાલ નાનાલાલ હળવદીયા હસ્તે પારાયણ, ચેતનકુમાર હળવદીયા તથા ચિરાગ રસીકભાઈ તથા સત્સંગીજીવન પ્રસંગ નિમિતે	મોતેયા લાડું ગાંઠીયા
૬	૮-૪-૦૬	" ૧૦	માંડવી(નાગલુપુર)	અ.નિ. પ્રેમભાઈ નાથાભાઈ	મોહનયાળ ગાંઠીયા
૭	૯-૪-૦૬	" ૧૧	ભરૂચ	સ્વ. સુર્યકાન્ત જગન્નાથ મહારાજના મોક્ષાર્થે હસ્તે અશોકકુમાર મહારજ	શીખંડપુરી, બટેટાવડા
૮	૯-૪-૦૬	" ૧૧	સામત્રા	અ.નિ. જાદવભાઈ મુળજીભાઈ	રસોઈ સીધા નિમિતે
૯	૧૦-૪-૦૬	" ૧૨	દોલતી	નાથાભાઈ હરદાસભાઈ સોડવળીયા હસ્તે ભુરાભાઈ	મોતેયાલાડું, મોહનયાળ, સાટા, ભજીયા
૧૦	૧૧-૪-૦૬	" ૧૩	સુરત	અ.નિ. શાં. ચો. ગજરાબેની તીથી નિમિતે હસ્તે ઉર્મીલાબેન દેસાઈ	ચુરમાનાલાડું, ગાંઠીયા
૧૧	૧૧-૪-૦૬	" ૧૩	વડોદરા	ભાવેશકુમાર પ્રકુલભાઈ પટેલ	રસોઈ સીધા નિમિતે
૧૨	૧૨-૪-૦૬	" ૧૪	ગઢડા	સ્વા. પુરૂષોત્તમપ્રકાશદાસજી ગુ. સ્વા. ઈશ્વરચરણદાસજી અ.નિ. પુ. સ્વા. હરિકેશવદાસજીની તીથી નિમિતે	મોહનયાળ, સેવ
૧૩	૧૩-૪-૦૬	" ૧૫	ભુપગઢ	અમરાભાઈ કરશનભાઈ સીંધવ તથા ધર્મપત્ની ડાહીબેન	મોહનયાળ, સેવ
૧૪	૧૩-૪-૦૬	" ૧૫	બોટાદ	કિષ્નાબેન અર્જુનસીંહ ગોહીલ	રસોઈ સિધા નિમિતે
૧૫	૧૬-૪-૦૬	ચૈત્ર વદ-૩	ભાવનગર	વિમલભાઈ હરજીભાઈ ભીમાણી ચી. સમર્થની બાબરીનીમિતે	શીખંડપુરી, મોહનયાળ, મોતેયાલાડું, ભજીયા, સેવ
૧૬	૧૭-૪-૦૬	ચૈત્ર વદ-૪	ગઢડા	સ. ગુ. શા. સ્વા. ઘનશ્યામપ્રસાદદાસજી અ.નિ. ગયેયા સ્વા. મોરારીચરણદાસજીની તીથી નિમિતે	શીખંડરોડલી, મરયાના ભજીયા
૧૭	૧૭-૪-૦૬	" ૪	સુખપુર(કચ્છ)	વાલજીભાઈ દેવજીભાઈ વાઘાણી	રસોઈ સીધા નિમિતે

**માહે માર્ચ-૨૦૦૬ માં શ્રી ગોપીનાથજી મહારાજનો થાળ તથા ત્યાગી-સંતો બ્રહ્મચારી અને પાર્ષદોને આપવામાં આવેલ રસોઈના દાતાઓની યાદી**

અ.નં.	તારીખ	મહિના અને તીથી	ગામ	નામ	રસોઈની વિગત
૧૮	૧૭-૪-૦૬	" ૪	પીઠવડી	હસમુખભાઈ ઘનજીભાઈ સુહાગીયા	રસોઈ સીધા નિમિતે
૧૯	૧૮-૪-૦૬	" ૫	સેવણી	હસમુખભાઈ શંકરભાઈ પટેલ અ.નિ.પ્રેમીબેનના મોક્ષાર્થે	ભગજલાડુ, મેથીના ભજુયા
૨૦	૨૦-૪-૦૬	" ૭	દહીસર(કચ્છ)	પ્રેમભાઈ ખેતાભાઈ કાંચ	મોહનથાળ, સેવ
૨૧	૨૧-૪-૦૬	" ૮	અમદાવાદ	હંસાબેન નટવરલાલ કોટક શ્રીમદ ભાગવત પારાયણ પ્રસંગ નિમિતે	ચુરમાના લડુ, મેથીના ભજુયા
૨૨	૨૧-૪-૦૬	" ૮	સુરેન્દ્રનગર	ગ્રીકમભાઈ શામતીલાલ સોની	રસોઈ સીધા નિમિતે
૨૩	૨૨-૪-૦૬	" ૯	દુધાળા	જયાબેન માલાભાઈ માલવીયા	રસોઈ સીધા નિમિતે
૨૪	૨૨-૪-૦૬	" ૯	રાજકોટ	હિરાબેન રમણીકભાઈ વિરાણી	રસોઈ સીધા નિમિતે
૨૫	૨૨-૪-૦૬	" ૯	પુના	સોની લાલજીભાઈ યુનીલાલ	રસોઈ સીધા નિમિતે
૨૬	૨૨-૪-૦૬	" ૯	નિંગાળા	ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ વિઠ્ઠાણી દિકરીના સંકલ્પ નિમિતે હસ્તે વિઠ્ઠલભાઈ વિઠ્ઠાણી	શીખંડ રોટલી, ભજુયા
૨૭	૨૨-૪-૦૬	" ૯	ભુજ	મુળજીભાઈ કરશનભાઈ	રસોઈ સીધા નિમિતે
૨૮	૨૩-૪-૦૬	" ૧૦	આંબરડી	ગોવરઘનભાઈ મનજીભાઈ હસ્તે કરશનભાઈ, રમેશભાઈ, વિનુભાઈ	મોહનથાળ, મોતેયાલાડુ, મેથીના ભજુયા
૨૯	૨૩-૪-૦૬	" ૧૦	કુંડલી	સ્વ.પાર્વતીબેન કલ્યાણભાઈ	રસોઈ સીધા નિમિતે
૩૦	૨૩-૪-૦૬	" ૧૦	અમદાવાદ	મીનાબેન ભાનુપ્રસાદ	રસોઈ સીધા નિમિતે
૩૧	૨૩-૪-૦૬	" ૧૦	અમદાવાદ	વાસુદેવભાઈ મણીલાલ ઠક્કર	રસોઈ સીધા નિમિતે
૩૨	૨૪-૪-૦૬	" ૧૧	મુંબઈ	ઘનશ્યામભાઈ સોની	રસોઈ સીધા નિમિતે
૩૩	૨૫-૪-૦૬	" ૧૨	માનકુવા	વિનોદભાઈ કરસનભાઈ ભુડીયા	રસોઈ સીધા નિમિતે
૩૪	૨૫-૪-૦૬	" ૧૨	ફોટડી	કાનભાઈ શામજીભાઈ ખેતાણી	રસોઈ સીધા નિમિતે
૩૫	૨૫-૪-૦૬	" ૧૨	પીપરલ્લા	દલપતભાઈ મકનભાઈ બારૈયા હસ્તે ચીરાગકુમાર બારૈયા	મોતેયાલાડુ, મેથીના ભજુયા
૩૬	૨૬-૪-૦૬	" ૧૩	સુરત	જયલક્ષ્મીફેશન, ઉમીયાફેશન, લક્ષ્મીનારાયણ ડિઝાઈન હસ્તે કો.સ્વા.ભક્તિચરણદાસજી	મોહનથાળ, મોતેયાલાડુ, સાટા, પાપડી ગાંઠીયા
૩૭	૨૭-૪-૦૬	" ૦))	અમદાવાદ	હંસાબેન નટવરલાલ કોટક હસ્તે વર્ષાબેન શ્રીમદ ભાગવત પારાયણ પ્રસંગ નિમિતે	શીખંડ રોટલી, મેથીના ભજુયા
૩૮	૨૮-૪-૦૬	વૈશાખ વદ-૧	માનગઢ	વિરજીભાઈ પોપટભાઈ ગોયાણી	મોહનથાળ, મોતેયાલાડુ, મેથીના ભજુયા
૩૯	૨૮-૪-૦૬	" ૧	અમદાવાદ	હંસાબેન નટવરલાલ કોટક	રસોઈ સીધા નિમિતે
૪૦	૨૮-૪-૦૬	" ૧	સુખપુર(કચ્છ)	કુંવરજીભાઈ કાનજીભાઈ વાઘાણી	રસોઈ સીધા નિમિતે

## અષાઢ મહિનામાં યનાર અનામત તીથીની રસોઈની યાદી

અ. નં.	તારીખ	મહિના અને તીથી	ગામ	અનામત રકમ રૂ.માં	નામ	વિગત
૧	૨૮-૬-૦૬	અષાઢસુદ-૩	કેરાળા ધાર	૬૧૦૦૦/-	કાળુભાઈ રામજીભાઈ વાવીયા તથા ઘનશ્યામાઈ રામજીભાઈ વાવીયા	અ.નિ.ભં.સ્વા.હરીકૃષ્ણદાસજીની તીથી નિમિતે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૨	૮-૭-૦૬	" " ૧૨	ખોપાળા	૨૫૧૦૧/-	બાબુભાઈ કાનજીભાઈ પટેલ તથા નાગજીભાઈ કાનજીભાઈ પટેલ	ત્યાગી સંતો બ્રહ્મચારીઓ પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૩	૮-૭-૦૬	" " ૧૨	સુખપુર	૪૫૦૦૦/-	રાધાબાઈ શામજીભાઈ વરસાણી હસ્તે શા.ચો મણીબા	ત્યાગી સંતો બ્રહ્મચારી પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૪	૮-૭-૦૬	" " ૧૨	ગઢડા	૫૧૦૦૦/-	રવિ.ઈશ્વરજી વનદાસજી	સ.ગુ.સ્વા.ભગવતચરણદાસજી ની અ.વા.તીથી નિમિતે ત્યાગી સંતોને રસોઈ કરી જમાડવા
૫	૧૧-૭-૦૬	" " ૧૫	ગઢડા	૪૦૦૦૦/-	સ્વા. ઈશ્વરસ્વરૂપદાસજી સ.ગુ.કો.સ્વા.ધર્મપ્રસાદદાસજી	અ.નિ.સ.ગુ.સ્વા.ઘનશ્યામચરણદાસજી ની અ.વા.તીથી નિમિતે ત્યાગી સંતો બ્રહ્મચારી પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૬	૧૧-૭-૦૬	" " ૧૫	ભુપગઢ	૫૧૦૦૦/-	ડાહ્યાભાઈ ભગવાનભાઈ ગોહેલ હસ્તે શનાભાઈ તથા મોહનભાઈ	ત્યાગી સંતો, બ્રહ્મચારી પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૭	૧૨-૭-૦૬	" ૧૬-૧/૨	ગઢડા	૫૦૦૦૨/-	નિર્મળાબેન મનશુખલાલ દરજી તથા સહ પરિવાર હ. દિનેશભાઈ	ત્યાગી સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૮	૧૩-૭-૦૬	" " ૩	ગઢડા	૫૧૧૧૧/-	અ.નિ. સ.ગુ.કો.સ્વા.ધર્મકિશોર દાસજી	અ.નિ.સ.ગુ.કો.સ્વા.ઈશ્વરચંદ્રદાસજી ની તીથી નિમિતે ત્યાગી સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને રસોઈ કરી જમાડવા
૯	૨૨-૭-૦૬	" " ૧૨	ગઢડા	૩૫૦૦૦/-	સ.ગુ.સ્વા.વિષ્ણુપ્રસાદદાસજી તથા સ.ગુ.પુ.સ્વા.સ્વયંપ્રકાસદાસજી	અ.નિ.સ.ગુ.શ્રી મુક્તાનંદસ્વામીની અ.વા.તીથી નિમિતે સંતોને રસોઈ કરી જમાડવા
૧૦	૨૪-૭-૦૬	" " ૧૪	ગઢડા	૩૫૦૦૦/-	સ.ગુ. સ્વા.ધર્મજીવદાસજી હસ્તે સ.ગુ.સ્વા.ઘનશ્યામચરણદાસજી	સંતોને રસોઈ કરી જમાડવા
૧૧	૨૫-૭-૦૬	" " ૦))	ગઢડા	૭૫૦૦૧/-	સ.ગુ.સ્વા.અક્ષરપ્રસાદદાસજી હસ્તે સ.ગુ.પુ.સ્વા. દેવપ્રસાદદાસજી તથા પોપટભગત	જાદરીયાનો થાળ,બુંદીના લાડુ, સેવની રસોઈ કરી ત્યાગી સંતો, બ્રહ્મચારી, પાર્ષદોને રસોઈ કરી જમાડવા

નોંધ :- ઉપરોક્ત યનાર રસોઈમાં અનામતની રકમના વ્યાજમાં ઘટતી રકમ ભરવાની રહેશે જેની નોંધ લેવા વિનંતિ